



એપ્રિલ - ૨૦૦૬



કીદું અધિક ગટપૂર,  
સાત પુરી ચાર ધામથી જો ;  
પ્રેમાનંદ કહે યામ દુત,  
ભાગે ગોપીનાથ નામથી જો.

## શ્રી સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત

વર્ષ : ૨૭ - સંઘાંક : ૩૨૪  
એપ્રિલ - ૨૦૦૬

: સંચાલક તંત્રી :

કોઈારી શા.સ્વા.ધનશ્યામવલ્લભદ્વાસજ  
શ્રી ગોપીનાથજીઠેવ મંદિર  
ગઢા (સ્વામિના.)

: વાર્ષિક સમ્ભ્ય પદ :

રૂપિયા ત્રીસ

: આજ્ઞવન સમ્ભ્ય પદ :

રૂપિયા ત્રણસો

: વિદેશમાં આજ્ઞવન સમ્ભ્ય પદ :

બે હજાર

: છૃઠક નકલ :

રૂપિયા ત્રણ

: પત્ર વ્યવહારનું સરનામું :

શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય  
ગઢા - ૩૬૪૭૫૦

**ફોન: ૨૫૨૮૦૦ / ૨૫૨૯૦૦**

## અનુક્રમણિકા

ક્રમ	કૃતિ	પાના નં.
૧	કિર્તન - પ્રેમ રસાયન જે	૨
૨	દુર્ગપુર માહાત્મ્ય	૩
૩	બ્રહ્મરાક્ષસ - ૧૨	૫
૪	ભક્ત વત્સલ ભગવાન	૭
૫	ભક્તા ખ્યાન	૮
૬	આત્મધાતી સ્વીનો મોક્ષ	૧૧
૭	અક્ષર મુંકન ભક્તરાજ દરબારશ્રી દાદાખાયરનું જીવન ચરિત્ર	૧૨
૮	વ્યસન નરકનું દ્વાર	૧૬
૯	કંકચ (આયુર્વેદિક)	૧૭
૧૦	સંસ્થા સમાચાર	૧૮
૧૧	શ્રી ગોપીનાથજી મહારાજના આખા થાળની યાદી	૨૧
૧૨	માહે-ફેબ્રુઆરી-૦૬માં શ્રીગોપીનાથજીમહારાજ નો થાળ તથા ત્યાગી સંતો, બ્રહ્મચારી, પાર્ષ્ડોને આપવામાં આવેલ રસોઈના દાતાઓની યાદી	૨૬
૧૩	વેશીખ મહિનામાં થનાર અનામત તીથીની રસોઈની યાદી	૨૮

**ગટપૂર ધામનો મહિમાં અને દર્શન માટે  
ગટપૂર મંદિરની વેબસાઈટ જુવો  
www Gopinathji.com**

માલિક, મુદ્રક તથા પ્રકાશન : શ્રી સ્વામિનારાયણ મંદિર, ટેમ્પલ  
મેનેજરાં બોર્ડ વતી, સદરહું મંદિરના મુખ્ય કોઈારી શા.સ્વા.  
ધનશ્યામવલ્લભદાસ જી. ગઢા (સ્વા.) જિ. ભાવનગર,  
ઝોન નં. (૦૨૮૪૭) ૨૫૨૮૦૦, ફેક્સ નં. ૨૫૨૯૦૦.

મુદ્રણ સ્થાન : વૃંદાવન ઓફસેટ (શ્રી ગોપીનાથજી પ્રી. પ્રેસ),  
જુના બસસ્ટેશન સામે, બોટાદ રોડ, ગઢા (સ્વા.) જિ. ભાવનગર

## : અગત્યના સુચનો :

“શ્રી સ્વામિનારાયણ ધર્મ સિધ્ધાંત” શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર મેનેજલ ટ્રેસ્ટી બોર્ડ દ્વારા પ્રકાશીત થતું મુખ્પત્ર છે.

“શ્રી સ્વામિનારાયણ ધર્મ સિધ્ધાંત” ભગવાનશ્રી સ્વામિનારાયણના ધર્મ સિધ્ધાંતોના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશથી પ્રકાશીત થાય છે.

તમામ હરિભક્તોને આ માસિક પત્રના સત્ય બનીને આ ધર્મપ્રચારના કાર્યને વેગ આપવા જાહેર અપીલ છે.

તા. ૨૦ સુધીમાં અંક ન મળેનો પ્રથમ પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા બાદ કાર્યાલયને લેખિત જાણ કરવી.

દરેક પત્ર વ્યવહારમાં ગ્રાહક નંબર અવશ્ય લખવો.

## : લેખકોને :

આસ નોંધ :- લેખનું લખાણ

કાગળની એક બાજુએ

સવરણ અથારે લખીને

મોકલવું.

લખાણ સંપ્રદાયના માન્ય શાસ્ત્રોના સિધ્ધાંતો અનુસાર હોવું જોઈએ.

૦૦૦૦ — ૦૦ — ૦૦૦૦

સત્સંગ સમાચારો-સંસ્થા સમાચારોવગેરેજે કંઈ હોય તે સંકિમમાં અને બનેલ હક્કિત આધારે મુદ્દાસર મોકલવા.

## કિર્તન

### પ્રેમ રસાયન જે

પ્રેમ રસાયન જે જન પામે,  
તેહનો તે મારગ ન્યારો રે,  
પીડ બ્રહ્માંડમાં પ્રીત ન રાખે,  
ઉર ધારે પ્રભુ ઘારો રે રે - પ્રેમી. ૧

લોકલાજ મરજાદ ન માને,  
રહે હરિને સંગ રાચિ રે,  
ત્રિભુવનમાં તે ધન્ય ધન્ય અબળા,  
તેહની તે ભક્તિ સાચી રે - પ્રેમી. ૨

અબળાને આધીન શામળીયો,  
અજીત તે અબલા પાખે રે,  
પ્રેમીજન એ મરમને પ્રીછે,  
હરિસંગ માન ન રાખે રે - પ્રેમી. ૩

કામ કોધ મદ મોહતણાં દળ,  
પ્રેમી પાસ ન આવે રે,  
મુક્તાનંદ પ્રગટ પ્રભુ ઉર ધરી,  
લટકે શું લાડ લડાવે રે - પ્રેમી. ૪



નવીનભાઈ સી. પટેલ  
કડઘરા



# દુર્ગપુર માહિત્મ્ય

શ.સ્વા. છેષ્યાપ્રકાશદાસજી - ગાંધુર(સ્વા.)

## ગતાંકથી શરૂ :-

તે ઓરડાના ચોકમાં લીંબતરથી ઉત્તારદિશામાં શ્રીહરિએ પાર્શ્વથી પાસે એક જુવાર ભરવાની ખાણ ગળાવી હતી. અને તે વખતે શ્રીહરિએ તે ઓરડાની ઓસરીમાં એક માસપર્યત નિત્યાનંદદ્વારામી પાસે કથા વંચાવી હતી. અને તે ખાણમાં જુવાર ભરાવી તેનું ટાકણું સારી રીતે બંધ કરાવ્યું હતું શ્રીહરિ તે ખાણ ઉપર વારંવાર બિરાજતા હતા. તે વખતે અરજણાભાઈ નામના ભક્તજને શ્રીહરિને મણ જેટલા કંકોડા અર્પણ કર્યા તે શાક પ્રભુશ્રીહરિએ પોતે બનાવી વિષણુને મેવેદ્ય ધરાવી પોતે જમી તે પ્રસાદી સર્વસંતસમાજ અને દરબારટમાં રહેતા તમામ ભક્તજનોને જમાડી આનંદિત કર્યા હતા. હે રાજન ! પૂર્વદિશા તરફ દ્વારવાળા ઓરડાની ઓસરીમાં શ્રીહરિએ વસંતપંચમીનો સુંદર ઉત્સવ કર્યો હતો. તે ઓસરીવાળા ઓરડાની પાછળ પાંસુના નામના સ્ત્રીભક્તનો ઓરડો હતો. ત્યા પહેલા સંતો અને પાર્શ્વના જુદા જુદા એમ બે રસોડાં હતાં તેનાથી ઉત્તાર દિશામાં દેવાભાનો ઓરડો હતો. તે ઓરડામાં શ્રીહરિ પંદર દિવસ સુધી નિવાસ કરીને રહેલા હતા. અને હંમેશા ભોજન સાથે રોંગાણાનું શાક જમતા હતા. અને પ્રસાદીનું શાક અન્ય ભક્તને જમાડતા હતા. હે

રાજન ! ઉત્તાર દિશા તરફ દ્વારવાળા અને ઓસરીવાળા ઘેલાધાંદ્વારાના બે ઓરડા હતા. તેમાં પશ્ચિમ તરફના ઓરડામાં સારંગપુરના મોટારાઠો ધાધલ રહેતા હતા. અને તેનાથી જીજા પૂર્વ તરફના ઓરડામાં નાનારાઠોડધાધલ રહેતા હતા. તે બેશેમાંથી મોટા ઓરડામાં શ્રીહરિએ બે માસપર્યત ચાણવલ્કયસ્મૃતિની કથા કરાવી હતી. અને વળી ત્યાં સુરાભક્ત આદિભક્તો દ્વારા હાસ્યાલાપ કરાવતા હતા. મોટારાઠો ધાધલના ઓરડાની આગામ ચોકમાં સુંદર આંબલીનું ઘાંદું ઝાડ હતું. તેની નીચે શ્રીહરિ છઘરપલંગમાં બિરાજતા હતા. અને તે જ જગ્યાએ દાદાખાચર વગેરે ક્ષત્રિયભક્તોને પહૂંનો ખેલ શીખવતા હતા. એકવખત નાનારાઠોડધાધલ માંદા થયા હતા, તેમનો દેહ પડવાનો સમય પ્રાસ થયો જાણી તેમના સંબધીજનોએ શ્રીહરિને ત્યાં બોલાવ્યા, તેવી શ્રીહરિ સમગ્ર સંતસમાજ સહિત ત્યાં પદારી રાઠોડધાધલને દર્શન આપ્યું તે વખતે શ્રીહરિપ્રભુએ સંતોને કહ્યું કે હે સંતો ! અત્યારે આ ભક્ત તદ્દન વાસના રહિત થઈ ગયા છે. અત્યારે આનો દેહ પડે તો નિશ્ચિત આ ભક્તનો મોક્ષ થઈ જાય પરંતુ જો આનો દેહ પડી જાય તો તેના કુદુંબીજનો

અતિ શોકાકુળ થઈ જાય માટે હું મારા ભક્તજનોના સુખને કારણે આ રાઠોડઘાઘલને જીવાડીશ. આમ કહી શ્રીહરિએ મહાકાળથી તે રાઠોડઘાઘલનું રક્ષણ કરેલું છે.

શ્રી ચૈતન્યાનંદ સ્વામી કહે છે હે રાજન! ઉત્તરદિશા તરફ દુકાનોના માર્ગ થી પૂર્વમાં અતિ મોટો વંડો હતો તેમાં રાજુબાના ઘર હતા. ત્યાં શ્રીહરિ સંતપાર્ષદો સાથે જમેલા છે. અને ત્યાં ભક્તજનોની સભામાં બિરાજેલા છે. અને ત્યાં ચમત્કારી એવું ઐશ્વર્ય પણ બતાવેલું છે વંડાથી પૂર્વમાં નાનીબાનો શ્રેષ્ઠ વંડો હતો. તેમાં અમરસિંહ અને લાખાજુ નામના ભક્તોએ સંતપાર્ષદોએ સહિત શ્રીહરિને મિષાનક્ષેથી તૃપ્ત કર્યા હતા. અને શ્રેષ્ઠ ઉપચારોથી સર્વનું પૂજન કર્યું હતું અને પોતા તરફ જોઈ રહેલા તે બંને ભક્તોને અદ્ભુત ઐશ્વર્ય બતાવ્યું હતું, અને ઉત્તરદિશામાં કાથડમાલાએ ઘર કરાવ્યા છે. ત્યાં પહેલા અયોદ્યાંવાસીનો વંડો હતો. તે વખતે મોટા રામજીભાઈ ભક્તને અને નાના રામજીભાઈ ભક્તને આ બંનેએ સંતો-પાર્ષદોએ સહિત શ્રી હરિને તે વંડામાં પદ્ધરાવ્યા અને સુંદર મોટા પલંગ ઉપર કોમળ ગાઢીતકીયા ઉપર શ્રીહરિને પદ્ધત્વા અને પાર્ષદોને પણ યથાયોગ્ય આસને બેસારી સુંદર એવા ઉપચારોથી પૂજન કર્યું અને સવને વરાઓ ઓટાડયા હતા આ જ જગ્યાએ આ સમાધિસિદ્ધ સચિંદાનંદસ્વામીનો વંડો હતો.



શ્રીહરિ કયારેક બે બે દિવસ સતત કયારેક ચાર ચાર કાયરેક આઠ આઠ દિવસ સતત નિવાસ કરીને રહેતા હતા. હે રાજન! સચિંદાનંદ સ્વામીના નિવાસસ્થાનમાં પણ શ્રીહરિએ દિવ્ય ઐશ્વર્યો બતાવ્યા છે. વળી તે વંડામાં ગૃહ્મપણે નિવાસ કરતા હતા. તે વંડાની સમીને બીજો જે વંડો હતો તેમાં અનાજ ભરવાનો પાખાણનો ચણાવેલો કોઠાર કરાવ્યો હતો. ત્યારે દાદાખાચરે તેનું વાસ્તુ પણ કર્યું હતું. અને સંતસમાજે સહિત સર્વને મિષાનક્ષેથી તૃપ્ત કર્યા હતા. અને શ્રીહરિનું પૂજન કરી સર્વ સંતસમાજની પણ પૂજા કરી હતી.

બંને તરફ મકાનોની વચ્ચે જે શેરી રહેલી છે તેનાથી પશ્ચિમદિશા તરફના ભાગમાં મોટો વંડો હતો. આશ્રિતજનો સાથે શ્રીહરિ ત્યાં પણ પદ્ધરાતા હતા. એ વંડો પુંજાભક્તનો હતો. તે વંડાની પાસે શેરીથી

પૂર્વદિશામાં મોટીબાનો વંડો હતો. શ્રીહરિ ત્યાં વારંવાર બિરાજતા, હરતા, ફરતા હતા. તે વંડાથી અને શેરીથી પશ્ચિમભાગમાં ગોવિંદજી અને દેવજી નામના ભક્તોના ઘર હતા. તેમાં એક વખતે દેવજીભક્ત માંદા થયા તે જાણી શ્રીહરિ મુનિજનો સાથે તેમને દર્શન આપવા પદ્ધાર્યા અને દર્શન આપીને તેનો મોક્ષ કર્યો. ધર્મવંશીના બે વંડા હતા તેમાં એક અયોદ્યાપ્રસાદજીમહારાજનો અને બીજો રધુવીરજી મહારાજનો વંડો હતો. (હાલ લીલાદાવાળો વંડો કહેવાચ છે તે જગ્યાએ આ બંને વંડા હતા.) (વધુ આવતા અંકે)

## ભ્રષ્ટરાક્ષસ - ૧૨

સ. પુસ્તકી સ્વામી કૃપાલસાહેબજી - ગંડા

ગતાંકથી શરૂ :-

એક ભૂત વિદ્યાર્થી હસતો હસતો અને સુગ્રો ગોખતો ગોખતો કમાડ ઉધાડવા આવ્યો : 'કડ્ડ્ડ' અવાજ કરતું કમાડ ઉધાડયું : 'અંદર જોતા કુમારને જણાયું : 'આહાહા, આવું વિદ્યાપીઠ ગુજરાતભરમાં નથી, હું કૃતાર્થ થયો: મને આવા વિદ્યાશીલ ગુરુદેવ મહિયા ! '

એમ વિચાર કરતો કરતો સીધો ગુરુદેવ પાસે જઈ તેમને નમ્યો, વંધો આચાર્યના અંકમાં ટછ્યો પંડિતના વેશમાં બેઢેલા ભ્રષ્ટરાક્ષસે કુમારને ઉઠાડ્યો, કુશળતા પુછી અને આવાગમનું કારણ પૂછ્યું: જવાબમાં કુમારે વિનીત ભાવે કહ્યું : 'જેમ ભગવાન પરશુરામ પાસે કર્ણ મૈત્રાવર્ણથી પાસે યાજ્ઞવળ્ય, અને વિશ્વામિત્ર મુનિ પાસે ગાલમ, વિદ્યા ભણવા ગયો હતો, તેમ હું પણ આપની પાસે વિદ્યા ભણવા આવ્યો છું : તો ગુરુદેવ મને વિદ્યાનું દાન આપો.'

વિદ્યાદાન દેવામાં અમારી ના નથી. પણ કુમાર, અમારા વિદ્યાપીઠના નિયમો બહુ કડક છે. તે તારાથી પળાશે ? સાંભળ, તો તારે ભણાવું હશે, તો આ મકાન બારુ જવાશે નહિઃ અમારું નામ-ઠામ-જાતિ-ગોત્ર કોઈ દિવસ પૂછાશે નહિઃ : કચાં ભણ્યો એમ કોઈ કહે, તો અમારું સ્થળ બતાવાશે નહિ. અમારી સાથે ભણવા સિવાય અન્ય વાતો થશે નહિઃ આ પડથારના પગથીયા નીચે ઉત્તરાશે નહિ અમારા સરસ્વતી મંદિરમાં

વિદ્યાર્થી વર્ગને તમામ ખાન પાન, આરામ, વસ્ત્રદાન, પુસ્તકદાન વગેરે અપાય છે: એટલે બહાર જવા કરવાની જરૂરત રેતી નથી: અહીં તો અસિધારા પ્રત છે: આ ઘોળકામાં આટલી મુંજની ધારાનગરી છે: સમજયો, ભોલ, જે તારો દીંછામાં આવે, તો અમે રાખીએ: આ ભધા વિદ્યાર્થીઓ આવા કઢણપ્રત લઈને અમારા વિદ્યાપીઠમાં દાખલ થયા છે હવે કહે ભાઈ, તારો શો વિચાર છે ?'

હાલના ઉભરા ઠાલતા જેમ પિતા બોલે, તેમ વિદ્યાગુરુ બોલ્યા.

કુમાર પુનઃ ગુરુના અંકમાં ટછ્યો, અને મૂદુ વચ્ચે બોલ્યો:

'ગુરુદેવ, ગુરુદેવ, હું તમારો છું : તમારે શરણે આવ્યો છું : મને વિદ્યાદાન આપો : હું તમારા વિદ્યાપીઠના કડકમાં કડક નિયમનું પાલન અવશ્ય કરીશ.'

તુરત 'હા.' કહેતા તેને તમામ સોઈ કરી આપવામાં આવીઃ સીધા-સામાનનો બંદોબસ્ત વિદ્યાગુરુએ કરી આપ્યો : કુમાર ભણવા લાગ્યો : હૈયાને હેઠે સુપાત્ર મળતાં ભ્રષ્ટરાક્ષસે વિદ્યા ઠાલવવા માંડી : ભણાવી ગણાવીને ટુંક સમયમાં મહાનિષ્ઠાંત કર્યો.

કુશાગ્ર બુદ્ધિશાળી કુમારે પણ વિદ્યાનું યથેચ્છ પાન કરવા માંડયું : દિને દિને ભ્રષ્ટતેજ

ગળકવા લાગ્યું : કુમાર લાગલાગઠ ગ્રણ વરસ ભણ્યો.

એક દિવસ પ્રભાતમાં કુશળ બનેલો કુમાર ઘર તરફ જવા પણ તૈયાર થયો : ગુરુદેવે આશિષ આપીઃ કુમારે તે માથે ચડાવી : કુમાર નીચે ઉત્તર્યો : ગુરુએ પુનઃ આશીર્વાદ આપ્યો :

‘ભાઈ , તારી વિધા ફળીભૂત થજો : દિગ્મંડળમાં તારી ખ્યાતિ ખુલ વધજો : જા ભાઈ, સુખી થાઃ હવે આ ભુવનમાં ફરી વખત આવીશ નહિં : આ સ્થળ સામુ ફરીથી કોઈ દિ જેદીશ નહીં :

‘કયાં ભણ્યો ?’ એમ કોઈ પૂછે, તો અમારું આ ગુમ વિધાપીઠ બતાવીશ નહિં અમે કીર્તિભોગી નથીઃ પણ કર્તવ્ય ભોગી છીએ. એવો અમારો સજ્જડ મુદ્રાલેખ છે. વિશોષ તને શું કહું ? જાવ બેટા સુખી રહો : અને ભણેલી વિધાનો વિસ્તાર કરો.’

કુમાર વંદન કરી ચાલ્યો: એક હેતાળ વિધાર્થી ડેલી સુધી વળાવવા આવ્યો જેવો કુમાર બહાર નીકળ્યો, તેવું જ પાછું હાર બંધ થયું કુમાર ચાલી નીકળ્યો.

‘અલ્યા એ, આતો પેલો દ્રાહણનો છોકરો : આપણે ભુતીયા મકાનમાં હડસેલ્યો તો એ.’

‘પણ એલા ત્યાં ભૂતખાનામાં જીવતો કેમ રહ્યો ! ચાલો જરા આડકતરી રીતે પૂછી જેદીએ: મગનું નામ નહિં પાડીએ, અને અવળું પૂછી મૂળમુદ્રો પકડી લેશું’ ‘ચાલો ત્યારે.’-કહી સો સામા ઉતાવળા ચાલ્યા અને ભુદેવને જોઈ ‘રામરામ’ કહી ઉભા રહ્યા.

‘ભાઈ કયાંથી આવો છો ?’ એ કે કહ્યું.

‘કયાંથી શું ? તમારા ગામની ગુમ વિધાપીઠમાંથી; તમે મને ચીધી હતી ત્વાંથી: ભાઈ, તમારો હું ઉપકાર માનું છું : કારણ કે મને વિધા પ્રાપ્ત કરવામાં તમે સહાયશીલ બન્યા.’

આ સાંભળી પૂછનારાઓ એક બીજાની સામું જેવા લાગ્યા, અને હોઠમાં હસવા લાગ્યા : ‘મા’રાજની ડગળી ખસીતો નથીને ?’ જીજે હળવે રહીને બોલ્યો.

ના, ના, ખસે શું ? મરનારો મહાવિદ્ધાન હતો, માટે આને જરૂર ભણાવ્યો હશે: એમાં શંકાનું સ્થાન છે જ નહિં’

‘ભાઈ તમો ભણ્યા ખરા: તમારા ગુરુદેવ કોણ ? કોણી પાસેથી આવુ અમુલ્ય વિધા રણ મેળવ્યું ? કહો જોઉં ?’ ત્રીજો બોલ્યો.

‘પણ મને એ ભાબત પૂછ્યાની તેઓએ ના પાડી છે’ ‘અનું નામ જ મોટાઓની મોટાઈ; જે પોતાનું નામ બહાર ન આપે: પણ આપણે જાણ ખાતર જાણવું જેદીએ ને ?’

ત્યારે તમે કહો તો હું પાછો વળી પુછી આવું’

‘હા, હા, પુછીઆવો: સાથો સાથ ગોત્ર, શાખા, અને પ્રવરની નોંધ લેતા આવજો, હો ભાઈ: એટલે વળતે દિવસે મનમાં અભળખા રહી જાય નહિં’

‘ઝંગ-ભલે’ કહી કુમાર પાછો વળ્યો: આમ કુંભાણું મૂકી આળવેતરાઓ આડાઅવળા થઈ ગયા.

આ તરફ બહારાક્ષસે વિચાર્યુ :  
(અનું સધાન પાના નં. ૮ પર)

## ભક્ત વત્સલ ભગવાન

રજુ - ગુણવંત એમ. ખાટસુરિયા-ગઢા(સ્વા.)

મેધપુરમાં સુંદરજીભાઈ નામના એક હરિભક્ત હતા. તેઓ વાણીયા હતા છતાં સોનાનો ધંધો કરતા હતા. સાચા સત્સંગી હતા મેધપુરથી અવાર-નવાર માલ ખરીદવા તેઓ જામનગર જતા.

એક વખત જામનગરથી સોનું, રૂપુ, માણેક વગેરે કિંમતી માલ લઈને પોતાના ગામ મેધપુર તરફ આવે છે પગપાળા ચાલતા ચાલતા સુંદરજીભાઈએ ઘણો રસ્તો પસાર કરી નાખ્યો. ચોરોને સુંદરજીભાઈ કિંમતી માલસામાન ખરીદીને આવી રહ્યા છે તેની જાણ થઈ ગાઈ આ સુંદર મોકો છે. આંકડે મધ્ય એ પણ માખીઓ વગરનું ! આવું જાણીને ચોરોએ સુંદરજીભાઈ ને લુટવાનું નક્કી કર્યું. દૂરથી તેમને આવતા જોઈ ચોરોઠો ઉડી ખાઈ માં સંતાછ ગયા સુંદરજીભાઈ કિર્તન ગાતા-ગાતા ઉત્તાપણ પગલે ચાલ્યા આવે છે.- “તારી મૂર્તી લાગે છે મને ખ્યારી રે, શ્રી ધનશ્યામ હરી, રડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ધનશ્યામહરી,”

ત્યાં તો ચોરો ઘોડા ઉપર બેસીને આડા ફરી વળ્યા. સુંદરજીભાઈ તો બીચારા ધૂજવા લાગ્યા ! હવે શું કરવું ? મનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું રટન ચાલુ છે. ભયંકર વન છે. સાંજનો સમય છે કોઇ માણસ દેખાતું નથી ચોરોઠો સુંદરજીભાઈનો હાથ પકડી પરાણો નદી હતી તે બાજુ લઈ ગયા અને કહ્યું “તારી પાસે જે વસ્તુ છે તે મને બધી આપી દે! નહીંતર જાનથી મારી

નાખીશ!” ડરના માર્યા ભગતે તો જે કષ સોનું , રૂપુ , માણેક જે કષ હતું તે બધુ તેમને આપી દીધું. બીજો ચોર કહે “ આને જીવતો ના જ્યા દેવાય નહીંતર તે આપણાને પછી પકડાવી દે છે. માટે આને મારી નાખવો જેથી આપણાને કોઇની બીક ન રહે.”

ચોર તો તલવાર ઉગામીને સુંદરજીભાઈને મારવા જાય છે. ત્યાં તેઓ જોરથી રાડો પાડવા લાગ્યા “ હે ! સ્વામિનારાયણ ભગવાન ભયાવો!” ચોર કહે. “ મુંગો રહે. જો રાડ પાડીશ તો મારી નાખીશું કોઇ રાડ સાંભળી જશો તો અમે પકડાઈ જશું માટે રાડા રાડ ના કર.” સુંદરજીભાઈ એ કહ્યું. “ મને મારશો નહીં. મારા પરિવારનું પાલન પોષણ કોણ કરશો? મારું કુટુંબ નિરાધાર બની જશો ભાલ-ભર્યા રહડી પડશો માટે તમને જે જોઈએ તે બધુ લઈ જાવો પણ મને જીવતો રહેવા દો”

ચોર કહે. “ તને અમે જીવતો રાખીએ તો અમને પકડીને મારી નાખે. એવું કોણ કરે? અમે જેને પકડીએ છીએ તેને મારી નાખીએ છીએ.” એમ કહી દાત કચકચાવી જોરથી સુંદરજીભાઈની ઉપર તલવારનો એક ધા કર્યો. સુંદરજીભાઈ બેવડા વળી ગયા. તો પણ કાછ વાગ્યું નહીં. ફરીથી તલવારનો બીજો ધા કર્યો. બીજો ધા છાતી ઉપર કર્યો. તો પણ કાછ વાગ્યું નહીં. કપાસનાં ટગલા ઉપર તલવારનાં ધા થાય તેમ ધા થાય છે. પણ જરાચ વાગતું નથી. ચોરોને

નવાઈ લાગીગાઈ ! આ શું હશે ? એક જાટકે માથું ઉડી જાય પણ આને તો તલવારનાં ઘા જવાગતા નથી ! ચોક્કસ આની પાછળ કંઈક મંત્રંત્ર હોવો જોઈએ.

આ ભાજુ ભક્ત સુંદરજીભાઈ પણ વિચારે છે. “ મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ મારુ રક્ષણ કરવા આવી ગયા લાગે છે. નહિતર હું જીવતો રહી જ ન શકું ! એક જ ગ્રાટકે માથું ઉડી જાય ! ” સુંદરજીભાઈ માં હિંમત આવી ગઇ હવે તેઓ જોરથી શ્રી સ્વામિનારાયણ મહા મંત્ર ધૂન બોલવા લાગ્યાં.

ચોરોને થયું કોઈ સાંભળશે તો આપણને પકડી જશે. તેથી એક ચોર સુંદરજીભાઈ પર ઘસી જઈને ડોક પકડીને ભીસી ઢીઘી.ત્યા પ્રભુ મદ્દમાં આવી ગયા. સિંહનાં રૂપમાં ભગવાને જોરદાર ગ્રાડ પાડી આપું વન ગાજુ ઉઠ્યું. ચોરો ફૂફડ્યા, “ ભાપ....રૈ....મરી...ગયા..આ..તો ભંયકર સિંહ આવી ગયો ! ” સિંહે તો ચોરની ગરદન પકડીને એવો છંછેકચો કે તરત જ તેના પ્રાણ નિકળી ગયા. ચોરની છાતી પંજાથી ચીરીનાખી. સુંદરજીભાઈ આ જોઈને એવા ડર્યા કે દોડી ને નદીમાં ભેસી ગયા. બેઠા-બેઠા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યાં.

ભગવાન વિકરાળ સિંહમાંથી સહજનંદ બની ગયા. શૈતવઞ્ચ, પીળુંપિતાંબર, હાથમાં ગુલાબની સુંગાધ લેતા હસ્તે મુખે ઉલા છે. આ જોઈ સુંદરજીભાઈ દોડી ને પ્રભુને પગે લાગીને રડી પડ્યાં, અંખનાં અશ્વું થી શ્રી પ્રભુનાં ચરણ પખાળતાં કહેવા લાગ્યાં. “ હે ! પ્રભુ તમે ખરો વેળાએ રક્ષા કરી, હું ધન્ય થએ ગયો. મહાપ્રભુ

તમેતો ખરેખર ભક્તવત્ત્વલ છો. કાયમ ભક્તોની રક્ષા કરો છો ! ”

શ્રીજી મહારાજે સુંદરજીભાઈ નાં માથા ઉપર હાથ મુકી ધીરજ આપતા કહ્યું , “ સુંદરજીભાઈ, જોખમ હોય ત્યારે એકલા કોઈ દિવસ જશો નહીં, પાછી રાત છે, નિર્જન રસ્તો છે, ધંધા માટે જવું હોય તો બે જણાને લઈને જવું.” આમ મહારાજે ભલામણ કરી.

“ ભલે લ્યો, હવે શાંતીથી ધેર જાઓ, તમારા માતા-પિતા પુત્ર, પરિવાર રાહ જુઓ છે.” આટલું કહી પ્રભુ અંતરદ્યાન થએ ગયા. ભગવાન ભક્તોનું રક્ષણ કરવા દોડી આવે છે, માટે ભગવાનની સાચા દિલથી ભક્તિ કરતા રહેયું. અને પરિપૂર્ણ વિશ્વાસ એક માત્ર સર્વોપરિ શ્રી હરિમાં જ રાખવો.

### (અનું સધાન પાના નં. ૬નું શારૂ)

‘ભુંડો કામો થયો: કાચી વચ્ચનો ભોળો કુરુંગ સમો કુમાર, લુચ્યાઓની મૃગીયાજળમાં ગપટાણો: મેં ના પાડયા છતા આવ્યો: અમારાં નામ, જાતિ, ગોત્ર સાંભળશે તો કેળના ગર્ભ જેવો કુમાર ઝડપાઈ જશે અને ભ્રલુછત્યાનું વૃથા પાતક ચટશે : આમ વિચારી વિચારી ભ્રલાક્ષસે પાછું વાતવાતમાં વિધાપીઠ શારૂ કર્યું : અને ભૂતાવળને પાછા વિધાર્થી બનાવી દીધા અને સ્વયં આચાર્ય બનીને બેઠા: ત્યાં તો કુમારે કમાડ ખખડાવ્યું કમાડ ઉધડયું : કુમાર ગુરુ પાસે ગયો : ગુરુને રોષ ઝળકયો : અને હાક મારી :

‘કુમાર કેમ આવ્યો ?’

(વધુ આવતા અંકે)

## “ભક્તાખ્યાન”

ગેમીલ એસ. સાંજણાવાવ.

સત્સંગના ખમીરવંતા ગણોદના કથિય જુણાભાઇ ના યોગે ભાયાવદરના સોમાજુ ખવાસને સત્સંગ નો રંગ લાગ્યો. ઘરના સંભ્યોને પણ ધીરે ધીરે સત્સંગના સંસ્કાર લાગ્યા. એકવાર ઘરના બધા મળી ગટડા મહારાજ ના દર્શન કરવા ગયા. મહારાજના દર્શનનો, સંતો દ્વારા ઉપદેશનો દિવ્યલાભ લીધો. દિકરી રૂપભાઈ ને રાજભાઈના શાઢો જુવમાં ગુણાદ ગયા કે આવા અમુલ્ય અવસરને, દેહ ને દેહના સંબંધી માટે તથા અલ્ય અને અંતે દુઃખનું કારણ એવા તુચ્છ વિષય ભોગ માટે વેડફાઇ નહીં. એ બધુ સુખ એક દિવસ નજર સામે ધૂળ થએ જવાનું છે. અંતે એક મહારાજનું સુખ રહેશે. એજ સાચો આપણા આત્માનો અવિરત આનંદ છે. આ શાઢો તીર જે મ હૃદયમાં વાગ્યા આથી નાની વચ્ચે સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન લદ મીરા જેમ ભક્તિ કરવાની ટેક લીધી. સંસાર ખારો અને નિરસ લાગ્યો ભજનમાં ભરપુર રહી દ્રટ નિયમો ને નિષાની ખુમારીમાં ભક્તિ કરવા લાગ્યા.

રૂપભાઈ ની સાવ નાની વચ્ચમાંજ સગાઈ થએ ગયેલી. ઉપલેટાના ખવાસ દેવાની સાથે એચ પણ શક્તિ પંથી ને દેવી ઉપાસક. પિતા સોમાજુ મુંજવણમાં પડ્યા કે, હવે શું કરવું ? એકવાર જુણાભાઇ સાથે ગટડા ગયા ને દિકરીની મુજવણ શ્રી હરિને કહી, દિકરીને ભક્તિનો રંગ લાગ્યો છે. સંસાર કરવો નથી અને સગાઈ થએ ગઈ છે. તે ત્યા બધા મહિન દેવી ઉપાસક છે. ભક્તા-

કુકડા કાપે મધ્યમાંસ ખાય કુંગાળીને લસણાની વાત જ શી કરવી ? મહારાજ કહે, “રૂપભાઈ ની શી ઇચ્છા છે ?” “મહારાજ ! એને તો તમારી રટના લાગી છે.” એના પિતાએ કહું મહારાજ કહે તો પછી એને પ્રભુ ભજવા દો ને! પણ મહારાજ ! અમે તો લોક લાજ માં ને વિષય માં બંધાયા છીએ. તે એમા રહી તમને ભજુએ. મહારાજ કહે તમે શેમા રાજુ? સોમાજુ કહે પરણીને પ્રભુ ભજે તો ઠીક !

મહારાજ હસીને કહે અમારી રૂપાને અનન્ય નિષા ને અમારો વિશ્વાસ એતો સોના રૂપા જેવા જ છે એમના હૃદયમાં એ લોહીમાં વણાય ગયા છે માટે એમને સંસાર કંઈ નહીં કરી શકે ને એમના દ્વારા સત્સંગ ઘણાને થશે. માટે જાવ રૂપાને કહેજો સુખેથી પરણી પ્રભુ ભજે અને જ્યારે આપદા આવી પડે તો અમાર ચિંતવન કરે. અમે સંદાય સાથે રહી સહાય કરશુ.

સમય જતા ઉપલેટાના દેવાજુ ખવાસ સાથે રૂપભાઈના ધામ ધૂમથી લગ્ન લેવાયા. સત્સંગના સંસ્કાર રૂપે કરીયાવર સાથે દિકરીને વળાવી. સોમાજુએ જમાઈને પહેલેથી જ કહી દીધુ હતું કે અમે સ્વામિનારાયણ ના ચુસ્ત આશ્રીત છીએ. આ ધર્મને લદ રૂપા આવશો. તે તમારે પાળવા દેવા પડશે. દેવાજુ એ કહું ભલે, અમને એમાં કાદ હરકત નથી.

રૂપભાઈએ સંસારની ચોપાટમાં પ્રવેશતા પ્રથમ સાસરીયાને આંગણે પગ દીધો કે તુરત ત્યાનું વાતાવરણ પામી ગયા. જેના ઘરમાં સત્સંગ

ન હોય ત્યાં વંશ વર્તન ને વાણી કેવા વિચિત્ર હોય. તેનું અસંક્રાતી વરવું દર્શન તેમને થયું. ઘર આંગણે કુળદેવી માતાનો મટ હતો. આ સ્થાને ખવાસ પરીવારો મરણ પરણાને માનતા વખતે બજી વધેરતા, છોકરું જન્મે એટલે પ્રથમ માતાને ભોગ લાગે. બાળક મોટું થતા ગડથોલ ખવડાવી માતાને ચરણે આળોટતું કરે, કોઈ લાપસી આરે. કોઈ નાળીચેર ફોડે, ને વાર તહેવારે વળી ભુવા ધુણતાને ડાકલાતો વાગ્યા જ કરતા. દાણા જોવાતા હોય. આવું ચાલ્યા જ કરે. એટલે ત્યાં ગાંજામાથી ધુમાડા ના ગોટા અખંડ નીકળતા હોય અફિણ ઘોળાતું હોય હોકા ગગડાવતા હોય, ભુવાની ધુઘકારી સંભળાતી રહેતી, ભુવો કોઇપણ ઉચારે એને વેદ વાક્ય મનાતું. સાક્ષાત પ્રગટ થઈને ભોલે છે. એવી આસ્થાએ અભુદ લોકોમાં ઘર કરેલું દાણા જોઈ નડતર દૂર કરવું, સંતાન પ્રાપ્તિને માનતા માટે પાડાતું બલિદાન. નાનામોટા કામમાં દોરા ધાગા કરવા, મેલીવિધાને જંગ મંત્ર ના જોરે પ્રજાને ભયમાં રાખવી. વાવાગોડું આવ્યું કે માતાનો કોપ થયો. દુકાળ પડવો કે માતા કોપી તાવ તરિયો કે પેટમાં દુઃખ તોચ બસ માતા કોપી! આમ બધીજ બાબતમાં માતા નો કોપ રૂપી ભુત અખંડ વળગોલું રહેતું.

સહજાનંદ સ્વામિના નિરાણા સંતો ગામડે ગામડે વિચરતા ત્યારે આવા ભયથી ગ્રાહીમામ પોકારતી પ્રજાને સાચી સમજ આપી સત્સંગની શીતળતા આપતા લોકો નિર્ભય થતા ને શાંતી વળતી લોકો એક નવા આનંદનો

**અનુભવ કરતા**

રૂપભાઈ પરણીને આ ઘરમાં આવ્યા, તે દિવસેજ રિવાજ પ્રમાણે કુળદેવી પાસે ગાંઢ

છોડાવીને પગે લાગવા જવાનું સાસુ સસરાએ કહું રૂપભાઈએ યોઝુ કહી દીધું. “મારે તો ગઠડાની માનતા છે. મારા પ્રભુ પાસે જઈને પગે લાગી ગાઠ છોડીશ. રૂપભાઈના તેજ પાસે તો ઝાંખા થઈ ગયા કોઈ ભોલી શક્યા નહીં.

સમય જતા ઘરમાં કંકાસ વધ્યો. રૂપભાઈ રોજે સાસુ સસરાને જય સ્વામિનારાયણ કહી પગે લાગવા જતા તેથો તેમને અનેક પ્રમાણે મેણામારી વાકુ ભોલી હેરાન કરે. દેવાજુ પણ હરકત કરે. પરંતુ તેમને છેવટે થયું કે મારે આંખી ઝુંદગી આમની સાથે રહેવાનું છે, શા માટે ઘરમાં ખોટો કંકાસ કરવો ? કયા એ ખોડું કરે છે પણી દેવાજુ જૂદા થયા. રૂપભાઈને નિરાંત થઈ રસોઈ કરી મહારાજને થાળ ધરાવવો વગેરે સેવા સુખેથી થવા લાગી. ભજન ભક્તિમાં નડતર દૂર થઈ ઉપલેટામાં આહિર ઝાતિના મલાધને રૂપાએ બે બહેનોને સત્સંગ થયો અવાર નવાર સમેયા. ઉત્સવમાં અણોય જણા ગઠડા જુનાગઢ જતાને મહારાજના દર્શન કરે સંતોની કથાવાર્તા સાંભળે વળી જુવુબા, રાજભાનો સમાગમ થાચ એટલે નિષાને મહિમાનો કેફથી હૈયુ છલકાચ જાય ને પાછા ધેર આવે . આમ સત્સંગ કરતા જેત જોતામાં છ-છ વર્ષો વીતી ગયા શ્રીજીની કૃપાથી રૂપભાઈને ગ્રાણ દિકરા ગુલાબના કુલ જેવા થયા માતાએ ધાવણ ધવરાવતાજ સત્સંગના સંસ્કાર રેક્ચા ગળથુથીમા સહજાનંદ પાચા થોડા મોટા થતા સંતોના હાથે કંઠી બાંધાવી વર્તમાન ધરાવ્યા.

રૂપભાઈનો દિચર ભુવો હતો તેણે તેના માબાપ ને કહું મોટા ભાઈએ એકેચ છોકરાને હજુ સુધી માતાને પગે લગાડ્યા નથી ને નિવેદ

પણ બાકી છે આ બહુજ ખોટું થયું છે તુજ તારી ભાબીને કહેનો! એમ કહી માબાપે ત્યાં મોકલ્યો તેણે જઈ કહ્યું ભાબી તમારા ત્રણે દિકરા મોટા થયા, હવે એને પગે લગાડી નિવેદ કરો સાથે ત્રણ લીલાનાળીયેર (બોકડા) વધેરો ને તમારેચ પ્રસાદી લેવી પડશો! તમે આપણા કુળ રીવાજ બાર કરી રહ્યા છો. રૂપભાઇના રૂવાડા બેઠા થયા. આંખ લાલ કરીને કહ્યું અમારે તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે તમારા આ અધર્મથી તો અમે ત્રાસી ગયા છીએ. શાંતી માટે નોખા રહીએ છીએ. હજુ કેડો મેલતા નથી? બહુ તમાર સહન કર્યું. હવે જરા પણ સાંભળશું નહીં! ને જે થાય તે કરી લેજો! જોજે હો જોવા જેવી થશે. લોહીના કોગળા કરીને છોકરા મરશો! તાર મોટું અપણું થશે અને જીવતા તુને ડાકણ કરીશ એમ દિયર ડરાવવા લાગ્યો.

રૂપભાઇ કહે “કર્તા હર્તા એક ભગવાન છે. એમના હલાવ્યા વિના પાંદડુય ન હલે તુ અને તારી દેવી શુ કરવાના છો? આ સાંભળી દિયર ધૂવા કુવા થતો ધેર ગયો. જઈ બધાને વાત કરો મારણે દેવીનું અપમાન કર્યું? એમના ભાપા કહે હવે કામ કળથી કરવું પડશો. આમા ભળ કે કર બતાવે નહીં ચાલે .

એકવાર રૂપભાઇ કામ પ્રસંગે બહાર ગયેલા. પાછળથી તેમના સસરાએ નિવેદની તેચાર કરી. ત્રણેય બાળકોને લઇ માતાને મટે ગયા ભુવા આવ્યા. ત્યાં રૂપભાઇ ઘરે આવ્યા ખભર પડી દોડતા ત્યાં આવ્યા રણચંડીનું રૂપ જાણેય તેમ હાંકોટો કર્યો. ભધા સજજડ થઈ ગયા

## આત્મધાતી શ્રીનો મોક્ષ

લેખક :- ગોવિંદભગત-સાતપડા

ટોરડામાં એક સમયે એક બ્રાહ્મણ શ્રીએ શોકચનુ મહેણુ સહન નહીં થવાથી કુવામાં પડી આપદાત કર્યો તેને ચમદુતો તેડવા આવ્યા ત્યારે ખુશાલ ભહે (ગોપાળાનંદસ્વામી) એ તેમને જતા રહેવાનું કહ્યું અને દર્ભની સળી તેમનાં પર ફેકીં. તેથી તેઓ ચીસ પાડીને નાસી ગયા. દર્ભની સળીની ઝડપ એવી લાગી કે ગામની ભાગોળે આવેલો ધેધુર વડલો કકડભુસ અવાજ કરીને તુટી પડચો આથી ગામ લોકોને લાગ્યું કે ગામનાં ટોર અને લોકોને ભેસવાની છગળાયા ગઈ, હવે તડકે ભેસવું પડશો. એ જાણી ખુશાલ ભહે લોકોને વડવા થડ, ડાળી ડાખળા વગેરે ત્યાંથી દુર ફેકી દેવા કહ્યું તે પ્રમાણે લોકોએ કર્યું ખુશાલ ભહે જે જગ્યાએ વડ હતો તે જગ્યા એ વડનું એક ડાખળુ(ડાળખુ) રોચ્યું અને તે ડાળખામાં આત્મધાત કરેલી બ્રાહ્મણ શ્રીના જીવને પ્રવેશ કરાવ્યો ભહે એક વખત ડાખળા ઉપર પાણી રેડયું અને દેવી શક્તિથી માત્ર ત્રણ રાગીમાં જ પહેલાના જેવું વડનું ઝાડ ઊગી નીકળ્યું પરિણામે પશુ અને મનુષ્યને છાયાનું અગાઉના જેવું સુખ મળ્યું આમ તે આત્મધાતી બ્રાહ્મણ શ્રીને વૃક્ષનો જન્મ પમાડી થોડાક વર્ષમાં સત્સંગમાં જન્મ આપ્યો અને ભગવાનની ભક્તિ કરી તે મોક્ષને પામી.

હાલ આ વડ ભૂલેશ્વર મહાટેવના દહેરા પાસે નદીનાં કાંઢે મોજુદ છે.

# ઉ અક્ષર મુક્ત ભક્તરાજ દરભારશ્રી દાદાખાચારનું જીવન ચરિત્ર ઈ

ગતાંકથી શરૂ :-

ગઠ ઉપરથી ગઠડા નામ પડ્યું આમ આશરે પ્રણાસો વર્ષથી એ પહેલા ગઠડા ગામ વસ્યું ગઠડા વસાવનાર મહાશૂરવીર મહાસમર્થ રાજ્યી ની ઐતિહાસિક સાબીતી આપતો એક દુછો આજે લોકજીલે જીવંત છે જ્યારે હાડીડાનો ત્યાગ કરી લોકખાચાર ના દિકરા ગાડા ભરીને હાલી નિકળ્યા ત્યારે ચારણ દુછો લલકારે છે કે વળે તો પાછો વાળજો, માણો

માંડચ કરે.

ભોકો ભાર ભર્યો,  
હાલ્યો હડીકા ઘણી.

આવા અતિ પરાક્રમી શુરવીર  
વડવાઓના વંશ માંજ એક  
પૂંજખાચાર થયા જેઓ મોટી  
ડેલીવાળા કહેવાય છે.  
ગઠડામાં તેમના વંશમાં  
જીવાખાચાર થઈ ગયા. જે  
મહા શૂરવીર હતા અને

ચીતળની લડાઇમાં પોતે લડવા ગયેલા અને  
મહા પરાક્રમ જતાવેલું તેઓ મહા દેનેશ્વરી પણ  
હતા. અને તેમના દરભારમાં સદાપ્રત અખંડ  
ચાલુજ રહેતું એકવાર દુષ્કાળમાં દાણા ખુટી  
ગયા ત્યારે એક મોટા જબરા માટીના કોઠામાં  
શ્રીજી મહારાજે અક્ષયપાત્રની જેમ અખુટ દાણો  
ઉત્પન કરી દુષ્કાળના કપરા કાળમાં સદાપ્રત  
અખંડ રાખેલું છે. ચીતળના આ ચુદ્ધમાં મોટા

અન. કે. વેકરીયા

મોટા પાણા પણ તણાદ જથ એટલું લોહી રેડાચું  
હતું અને આ શીતળની લડાઇમાં જ ભાવનગર  
ઢાકોર વખતસિંહજી ગોહિલે ગઠડા જીતી લીધું  
હતું ત્યારથી ગઠડા ભાવનગર તાબે છે. આ  
જીવાખાચાર અક્ષરમુક્ત દાદાખાચારના કાકા  
થાય. બાપુ જીવાખાચાર અને અભેલખાચાર  
ગઠડા અને આજુઝાજુના છ, છ, ગામના ઘણી  
હતા. તેમાં અભેલખાચારના  
તાબામાં ગામો હતાં. માંડવધાર,  
લાખણકા, નાનું ગીંગાવદર,  
તાજપર, સુરકા અને અદ્યુ  
ગઠડા તે શ્રી ગોપીનાથજી  
મહારાજના મંદિર તરફનો  
ભાગ મોટી ડેલીવાળા  
જીવાખાચારના ગામો અડતાળા,  
ઉગામેડી, શિચાનગર,  
ખોપાળા, વનાળી અને અદ્યુ  
ગઠડા તે ભડલી ઝાંપા તરફનું.

આ ખાચાર વંશમાંજ અગાઉ

એક ઉજ્જ્વલખાચાર થયા જેમનો વંશ નાનીડેલીમાં  
કહેવાય છે. તેમના જ વંશમાં દાદાખાચાર મહાન  
અક્ષર મુક્ત થઈ ગયા. દાદાખાચારને શ્રી  
હરિચરિત્ર ચિંતામણી ગ્રથમાં અર્જુન ના અવતાર  
કહ્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનનો રથ  
હાંકેલો તેમજ શ્રી દાદખાચારનો રથ ભગવાન  
શ્રી સ્વામિનારાયણે હાંકેલો. આ રથ પણ



ગટડામાં દાદાખાચરના દરબારમાં હજુ દર્શન દેતો મોજુદ છે. અર્જુન નરઅધિનો અવતાર હતા. એમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું છે. અર્જુન નરઅધિનો અવતાર હતા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ નો અવતાર હતા. આમ નર અન નારાયણ ની સનાતન જોડીએ ગટપુરમાં દાદાખાચર અને ભગવાન શ્રી સ્વામિનારાયણ રૂપે અવતાર ધારણ કર્યો.

ઉન્મતગંગા મહાત્મય નામે પ્રાચીન હસ્તલિભિત સંસ્કૃત ભાષાનાં ગ્રંથમાં આ નર અને નારાયણ ના આ કળિયુગમાં પુન: પ્રાદુર્ભાવનો એક સુંદર છતિહાસ પડેલો છે. પ્રાચીન કાળમાં વંકાચન મુનિઓ પોતાના આઠ પુત્રો અપ્સરા થકી ભણ થઇ અધોગતિ ને પામ્યા ત્વારે વંકાચનમુનિઓ ઘોર તપશ્ચર્યા કરી ગંગાજુને પ્રસંગ કર્યા. ગંગાજુથે મુનિને વરદાન આપ્યું કે હું તમારી પુત્રી રૂપે થઇશ અને નદીનું સ્વરૂપ ધારણ કરી તમારા પુત્રોનો ઉદ્ઘાર કરીશ. આ વરદાન પ્રમાણે વંકાચન મુનિને ઘરે તેમની પુત્રીરૂપે ગંગાજુ પ્રગટ થયા વચ્ચે વધવાની સાથે ગંગાજુથે શ્રીહરિની પ્રાસી માટે બદ્રિકાશ્રમમાં નર-નારાયણની પ્રસંગતા માટે તપશ્ચર્યા કરી. બ્રહ્માદિક દેવતાઓ સાથે નારદજુ ગંગાજુ પાસે આવ્યા અને ગંગાજુને દર્શન આપ્યું ગંગાજુથે પરબ્રહ્મના પ્રગટ સ્વરૂપની પ્રાસી માટે પોતે તપ કરી રહેલ છે તે વાત કરી નારદજુ પ્રસંગ થયા અને વર આપ્યો કે અક્ષરાધિપતિ પર બ્રહ્મ પોતે તારો મનોરથ

પૂર્ણ કરશો નારદજુ થકી વરદાન પારમેલી આ ગંગા પછી અધિક ઉત્સાહથી તપ કરવા લાગી ભગવાન શ્રી નર-નારાયણ પોતાનું પ્રત્યક્ષદર્શન ગંગાજુ એ પરબ્રહ્મનો નિત્ય સમાગમ થાય એ વર માગ્યો ગંગાજુનું વચ્ચન સાંભળી ભગવાને કહ્યું કે તારો મનોરથ પૂર્ણ કરવા તથા મારા એકાંતીક ભક્તોને અનેક પ્રકારે સુખ આપવા અમે આ પૃથ્વી માં પ્રગટ થઇશું અને પશ્ચિમ પાંચાળ દેશોમાં ગટડા નામે ગામમાં આવીશું અને ગટડાના રાજ એભલખાચરની ભક્તિને આધિન થઇ તેમના દરબારમાં જ કાયમ નિવાસ કરીને રહીશું તે વખતે મારી સાથે અક્ષરધામમાંથી આવેલા અક્ષરમુક્તો સંત હરિભક્તો સહિત નિરંતર તારા વિષે જ્ઞાન કરીશું આમ નરઅધિ તે દાદાખાચર અને નારાયણાંતે ભગવાન સહજાનંદ સ્વામી ગંગાજુના તપના પ્રભાવથી અને આ રીતે ગંગાજુના તપથી અને શ્રી હરિની પ્રસંગતાથી ભગવાન નર અને નારાયણ ગટપુરમાં અવતાર ધારણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષરમુક્ત દાદાખાચર રૂપે પ્રગટ થયા છે.


શ્રી હરિ ચચિત્ર ચિંતામણી ભાગ બીજો અને દુર્ગપુર મહાત્મય નામે સંસ્કૃત હસ્તલિભિત પ્રાચીન ગ્રંથમાં દાદાખાચરના વડવા ઉક્ષકાશરની વાત છે તે પણ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમા કાયમ નિવાસ કરીને રહેશે એવા વરદાન ની હકીકત દર્શાવે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુરુ

રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી સમર્થ સંત હતા તેમના શિષ્યોમાં બાળાનંદ અને વીઠલાનંદ નામે સંતો પણ હતા. ગટડાના દરબાર એભલખાચાર એકવાર કોઇ કામ પ્રસંગે બાબરીયાવાડાના ઉમેદ ગામે ગયા હતા અને લાખા પટેલની વાડીએ ગયા હતા ત્યાં બાળાનંદ એક ખુણામાં

એક નાનકડા લીંબડાના છોડવા સામું જોઈને હસ્યા ત્યારે કોઇએ પૂછ્યું કે આપ લીંબડા સામે જોઈ હસ્યા કેમ? તો કહે “આ લીંમડાના છોડ નીચે તો સાક્ષાત પરબ્રહુ બીરાજવાના છે” એભલખાચારે આ વાત ઉપરથી આ છોડવો લઈને ગટડામાં પોતાના દરબારગટની વરચેજ વાવી દિધો જે હાલ લીંબતર સ્વરૂપે

દાદાખાચારના દરબારમાં મોજુદ છે અને જે દેહે પોતે પરબ્રહુ ભગવાન સ્વામિનારાયણની પરચીસ વરસ ગટડામાં સેવા કરી એજ દેહે આપણને દર્શન આપી રહેલ છે. શ્રીહરિને સાક્ષાત મળેલાના દર્શન નો પરમ લાભ આપણને આજે પણ મળી રહ્યો છે. એ ભગવાન ની અપાર કૃપા આપણી ઉપર સમજવાની છે. લીંબતર પોતે મહાન અક્ષરમુક્ત જ છે.



આત્માનંદ સ્વામીના એક શિષ્ય મેનનાથજી કરીને હતા. તે દામનગાર પાસે કુંભનાથ મહાદેવની સેવા કરતા હતા ગટડાના દરબાર ઉદ્ઘાટ ખાચર ના પત્ની રાણાદેબાઈ એકવાર આ કુંભનાથ મહાદેવનાં દર્શને ગયેલા તેમને ઉદાસ જોઈને મેનનાથજી એ પૂછ્યું કે બેટા ઉદાસ કેમ? રાણાદેબાઈ એ “પુત્ર નથી તેથી પોતે ઉદાસ છે.” એમ કહી રડવા લાગ્યા મેનનાથજી એ આશીર્વાદ આપ્યા કે બાવાના વચને પુત્ર થશે. બાવા ખાચર નામ રાખજે નિશાનીમાં કાનની બુટ ઉપર શંકરની લિંગાનું નિશાન હશે અને ગટડા ના દર બાર ગાટ ની ગોશાળામાંથી માંડવ અધિનું પૂજેલું પ્રાચીન શંકરનું લિંગ

નીકળશે તે ઘેલાને સામે કાંઢે પદ્ધરાવજો અને નિલકંઠવર્ણી ભગવાન તમારે ઘરે પદ્ધારશે એવું વરદાન દીધું તે મુજબ કાળે કરીને ઉદ્ઘાટ ખાચરને ત્યાં પુત્ર જન્મ થયો તે ભાવાખાચાર તેના જ પોત્ર તે ગટપુર અક્ષરમુક્ત દાદાખાચાર. પછી એભલ ખાચરને શ્રીહરિ પ્રથમવાર જયારે ગટડામાં રહેવા આવ્યા ત્યારે શ્રીહરિએ સ્વમુખે આ બધો ઈતિહાસ વર્ણવી બતાવેલો છે.

શ્રીજી મહારાજ પ્રથમ ગટડા પદાર્થ

ત્યારે થોડો વખત જુવાખાચરના દરબારમાં રહેતા હતાં. પછી એભલ ખાચરે પોતાના દરબારગટમાંજ રહેવા વિનંતી કરી શ્રીજી મહારાજે પોતાને રહેવા માટે અક્ષર ઓરડી પસંદ કરી અને જુંદગીભર પોતે આ અક્ષર ઓરડીમાં જ નિવાસ કરીને રહ્યા અને લીંબતરીને પોતે અનેક લીલાઓ કરી ભક્તજનોને સુખ આપ્યું છે અનેક ચમલકારો બતાવ્યા છે અને અનેક વચનામૃતો પણ કર્યા છે.


શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર ત્રીજુ તરંગ પપ થી ડક ના સંશોધન થી જાણી શકાય છે કે સંવત ૧૮૬૧ માં જ્યા એકાદશીને દિવસે શ્રીજી મહારાજ કાયમી વસવાટ માટે ગટડા પદ્ધાર્યા તે પહેલા પણ સંવત ૧૮૫૮ ના માગશર વદ પડવાને દિવસે ગામ કરીયાએના થી કારીયાણી જતા વચ્ચે રોટા ટાણે ગટપુરને પાદર માં ભે ઘડી રોકાયા હતા અને હાલ દાતારની ધાર નામ ઓળ ખાતી જગ્યાએ એક બગીયામાં આરામ લીધો હતો અને તેજ વખતે પરબ્રહ્મે ઉન્મત ગંગામાં સૌ પ્રથમ વાર સ્નાન કરેલું છે શ્રીહરિએ વચનામૃતમાં પાંચ વિશ્રામ ૧૭માં શ્રીહરિનું સૌ પ્રથમ ગટપુર આગમન વિસ્તારથી વર્ણવેલું છે. સત્સંગાના ઈતિહાસ ની તે ધન્ય ક્ષણી હતી કે જ્યારે પરબ્રહ્મ એ દ્રારિકા ના શાખાનગર અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસાદી ની ભૂમિ ઉપર પગ મુકીને સંકલ્પ કરેલો કે પોતે અહીંજ કાયમી વસવાના છે અને અહીંજ

ગોપીનાથજી સ્વરૂપે પોતે અખંડ કાયમી નિવાસ કરીને ભિરાજવાના છે.

સંવત ૧૮૬૧ માં મહા સુદ એકાદશી જ્યા એકાદશીને પવિત્ર દિવસે શ્રીજી મહારાજે ગટપુરમાં કાયમી વસવાટ માટે પગમુક્યો કે મહાતીર્થ બની ગયું જ્યા એકાદશીને આપણે ગટપુર જ્યાંતિ તરીકે ઉજવવી જોઈએ કારણ કે જ્યા એકાદશીથી ભલાંડ નું સર્વ શ્રેષ્ઠ તીર્થ શિરોમણી પગલેજ તેને મળ્યું માટેજ સત્સંગમાં જ્યાં એકાદશી તે ગટપુર જ્યાંતી તરીકે અવશ્ય ઉજવવી જોઈએ ભવ બ્રહ્માદિક દેવો પણ ગટપુરની ૨૪ માથે ચડાવવા નિત્ય દિવ્ય દેહે ગટડાની યાત્રા કરે છે.

ગટપુરના ગામધણી દરબાર એભલખાચર કારીયાણી થી માંચાખાચર ના દરબાર માંથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ને ગટડા તેડી લાવ્યા અને કાયમ ને માટે પોતાના દરબારગટમાં જ વસાવી દીઘા સંવત ૧૮૬૧ માં શ્રીહરિ ગટપુરવાસી બન્યા

(વધુ આવતા અંકે)



શ્રી સ્વામિનારાયણ ભગવાન

## વ્યસન નરકનું દ્વાર

ગુણવંત એમ. ખાટસુરીયા- ગઢડા.

વ્યસનની પરિભાષાને સમજુએ તો વ્યસન માનવ જીવનમાં પ્રવેશેલી નકારાત્મ ટેવો કે શાશ્વત મૂલ્યોના સંદર્ભમાં ગણવામાં આવતી ખરાબ આદતોનો સમાવેશ થાય છે. વ્યસન એટલે નરકનું બંધન, વ્યસન એટલે નરકનું દ્વાર, વ્યસન એટલે વ્યથા, વ્યસન એટલે વિનાશનું સભક.

વ્યસન બરબાઈ લાવનાર છે. આજે વ્યસનોના ફંડામાં ફસાઈને લાખો ચુંચાનો બરબાદ થઈ રહ્યા છે. કોણ સમજાવશે એમને ? જો શારીરિક માનસિક અને આત્મિક શાંતિ જોઈતી હોય તો વ્યસનોના ફંડામાંથી વહેલી તક છુટવું ખુબ જ જરૂરી છે. સંસ્કૃતિ પ્રેમીએ એક ચુંચાનને પ્રશ્ન કર્યો “તમારી મુડી શું છે ?” કમસ્યુટરના ચુંચાને જલાબ આપ્યો-“હોટલ અને બોટલ ?” આવા ચુંચાનોને જગાડવાની ખાસ આવશ્યકતા જ નહીં પણ અનિવાર્યતા જ છે !

આજના ચુંચાની કરુણતા એવી છે કે દારુ પીવો એ એક વ્યસનના બદલે ફેશનરૂપ ગણાય છે જેના કારણે અનેક ચુંચાનો દારુ પીતા થઈ ગયા છે. વર્તમાન કાળમાં વ્યસન અને ફેશનનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. મોટા ભાગે પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધુ જોવા મળે છે. આજે વ્યક્તિ ખાવા પિવામાં નહીં હોય તેટલો ખર્ચ વ્યસન પાછળ કરતા હશે. આપણે વ્યસની ભાઈના મોટે જ સાંભળીએ “ પૂણ્યના ઉદ્ઘથી મને બધી રીતે સારું હતું મે

હાથે કરીને બધું બગાડી નાપણું લાખો રૂપીયા કમાયો પણ બધા વેડફી નાખ્યા સ્કુટર અને કાર વસાવી ચુકેલો હું માણસ છું પૂણ્ય પ્રતાપે ખુબ લક્ષ્મી પામ્યો હતો. પરંતુ બધું ડિડાવી દીધું ધનનાં મદમાં મા-ભાપ આદિકોઈને ગણ્યા નહીં. રવિવારે ફાઈવ સ્ટાર હોટલોની મુલાકાતો, વેકેશનમાં હિલ સ્ટેશનોના ચક્કરો, રાત્રે લફ્ઝા મિત્રો સાથે ભટકવું, અભક્ષ પદાર્થો ખાવા, સિનેમાં ધરોમાં જવું, આ વ્યસનોએ મારી જિંદગી પાયમાલ કરી નાખી ટુકમાં વ્યસનના કારણે બધું જ ગુમાવ્યું.”

કોઈ પણ વ્યસન શરૂઆતમાં નાનું જ હોય છે. તેથી તેને અપનાવતા ચુંચાનો વિચાર કરતા નથી. પછી એમાંથી છુટવું મુશ્કેલ થઈ પડે છે. હજુય કચાં મોડું થઈ ગયું છે ? જોઈ એ માગ દૃઢ મનોભળ ! ખરાબ વ્યસનો જીવનમાં પ્રવેશ નહીં તે માટે પ્રથમથી જ સાવધાની રાખો. કુમિત્રો સાથે હરવા- ફરવા નું છોડી દો મોટે ભાગે વ્યસનો ખરાબ મિત્રો ની સોભતથી જ આવે છે. સામાન્ય વ્યસનમાં ભારોભાર ઉપેક્ષા હોય છે. તેથી સહેલાઈ થી સેવે છે. અને પછી તેમાંથી છુટવું મુશ્કેલ થઈ પડે છે. આભાલવૃદ્ધ સો કોઈ તથા ખાસ કરીને ચુંચાનો પોતાના જીવનમાંથી વ્યસનોને તિલાંજલી આપે તેવો શુભ ભાવ તથા વર્તમાન કાળમાં પ્રચલિત કુવ્યસનો દુર થાય ને જીવન વ્યસન મુક્ત થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના....

# કાંકચ

કાંકચ ગુજરાતમાં બધે ઢેકાએ થાય છે.  
તેનું જાડ મધ્યમ કદનું તથા જાળ સમાન હોય છે  
તેના જાડને સર્વત્ર કાંટા હોય છે.

કાંકચનાં પાન સંચુક્ત, આમલીનાં પાન  
જેવા પરંતુ કંઈક મોટાં ને શાળીઓ પર સામસામે  
આપેલા હોય છે તેનાં પાનની સળી પર પણ ભારીક  
વાંકા વળેલા કાંટા હોય છે, તેમજ પાનની ડાંડી પર  
પણ કાંટા હોય છે. કાંકચનાં કુલ પીળાશ પડતાં  
હોય છે.

કાંકચની શિંગો પોટલી જેવી પગોળી અને  
કાંટાવાળી હોય છે તેમાંથી એક કે જે બૂનીકઠો  
છે. તેની શિંગો પાકી ને પોતાની મેળે કુટકી જાય  
છે અને બી નીચે પડે છે તેના બીને 'કાંકચ' કે  
'કરકચ' કહે છે બી રાખોડી રંગાનાં, ચાળકતાં,  
લીચા કઢણ હોય છે તેનાં બીને ભાંગતાં તેમાંથી  
ફિક્કો ધોળો પીળાશ પડતો ગર્ભ(મગજ) નીકઠો  
છે. તેની વાસ ઉગ્ર અને તેનો સ્વાદ કડવો હોય છે.  
આ બીને મંદ અભિનમાં શેકીને તેનો મગજ કઢાય  
છે.

કાંકચ બે જાતની થાય છે : ધોળી કાંકચ  
અને કાળી કાંકચ ટાટિયા તાવ(વિશમ જવરા) પર  
કાંકચ ફાયદા કારક છે. ટાટિયા તાવને કારણે  
ધાંદું કરીને વરોળની વૃદ્ધિ થઈ જાય છે અને પછી  
અપથ સેવનને લીધે તાવ ચાલુ રહે ચે. તેમાંથી  
કોઈ વાર મંદજવર પણ લાગુ પડી જાય છે આવા  
રોગીઓ માટે કાંકચ અતિ ઉપયોગી છે. કાંકચ  
ટાટિયા તાવ(વિશમજવર) પર કિવનાઈન કરતાં જો  
કે તેની અસર ધીમી થાય છે પરંતુ જેમને કિવનાઈન  
માફક આવતું ન હોય, ગરમ પડતું હોય, તેમને  
માટે કાંકચ ખાય વાપરવા લાયક છે. ચૂર્ણ તથા  
પેરના કુમિ પર કાંકચના બીના અંદરના  
ગોળા(મગજ)ને શેકીને ખાવાનો રિવાજ છે. કાંકચનાં  
મૂળ દશમુળમાં વપરાય છે ઓષધિ તરીકે તેનાં

-: લેખક:-

ડૉ. નેત્રપસાદ કૃષ્ણપસાદ દવે હેલ્થ  
કોર્નેટર સમન્વય સંસ્થા-દેવગાટ  
બારીયા (પંચમહાલ)

મૂળ, પાન અને બૂની વપરાય છે.

બંને જાતની કાંકચ તૂરી, કડવી, અનુવણા  
(ગરમ નહીં), બેણે દોષોને ઉણનાર તેમજ અર્દચિ,  
શ્વાસ, સોજો, લોહીવિકાર, ઊલરી, હેડકી અને  
તૃપારોગને મટાડનાર છે.

કાંકચ કુલ તૂરાં, મધુર, ઠંડા, હુદયને  
હિતકારી અને કફ તથા લોહીના બગાડને મટાડ  
નારા છે.

કાંકચનાં બી કંડને હિત કારી તેમજ પિતા,  
અતિસાર, હેડકી અને સક્ષપિતાને મટાડે છે. આમ  
કાંકચ મરીનું કાંકચ જવરદન, કૃમેદન,  
ગુલનાશક, કટુપોષિક અને વિષહર છે.

કાંકચનાં પાનના રસમાં મરીનું ચૂર્ણ લેવાથી  
શીતજવરમાં ફાયદો થાય છે

કાંકચ શેકી પાનના રસમાં થોડીક હિંગ  
નાખીને પીવાથી સર્વ પ્રકારના તાવમાં ફાયદો થાય  
છે.

શેકેલી કાંકચ(કરકચ) અને મરીનું ચૂર્ણ  
લેવાથી શીત જવરમાં ફાયદો થાય છે

કાંકચ શેકી, ગોળો (મગજ) કાઢી, તેની  
ભૂકી કરી, ગોળ સાથે ખાવાથી વાયુનો ગોળો મટે છે  
કાંકચનો ગોળો (મગજ) અને લનીંગ એકમ કરીને  
લેવાથી પણ વાયુનો ગોળો તાત્કાલિક મટે છે.

કાંકચનો ગોળો, અને સંચળ એકમ કરીને  
લેવાથી આફરો, અપચો અને ઉદરશૂન મટે છે.

કાંકચ ગોળો, સુંદ અને સંચળ વાટીને  
મધમાં ચાટવાથી પેટની ચુંક મટે છે. શેકેલી કાંકચના  
ગોળાનું ચૂર્ણ ધીમાં ચાટવાથી પણ પેટની પીડ(ચુંક) મટે  
છે.

કાંકચનો ગોળો, સેકેલું જુર્ઝ, વરિયાળી નું  
ભારીક ચૂર્ણ દિવસમાં ત્રણ વાર પાણી, છાશ કે  
મધમાં લેવાથી જુર્ઝ આમાતિસાર મટે છે અને  
આમાશચ તથા આંતરડાં બળવાને બને છે.

કાંકચના પાનનો રસ દુધ સાથે લેવાથી કે કાંકચના પાનના રસમાં આંભા હળદર અને અને માત્ર દુધ પર રહેવાથી સંગ્રહણીમાં ફાયદો થાય હિતપાપડો મેળવીને પીવાથી કૃમિ મટે છે.

દશ તોલા પાણીમાં ઢળિયા કાટેલી બે ખારેકો સાંજે પલાળી રાખી સવારે (અથવા, સવારે પલાળી રાખી સાંજે) મસળી, ગાળી, તેમાં ચાર-છ રતી કાંકચના ગોળાનું ચૂર્ણ મેળવી પંદર દિવસ સુધી પીવાથી અને પદ્ધતિનાન કરવાથી બરોળવૃક્ષ અને તાવ મટે છે.

કાંકતના પાનનો રસ અને સંચળ બરોળ કે કાળજા(ચકતા)ની ગાંઠ પર અપાય છે.

કાંકચના ગોળાનું ચૂર્ણ તાવની નબળાઈ પર અપાય છે એ ચૂર્ણ સૂતિકાજવરમાં આપવાથી પણ ફાયદો થાય છે.

બાળકોને ધાવણ ન પચવાથી સફેદ ઝડા કે ઉલટી થતાં હોય તો કાંકચ શેકી, ભારીક વાટીને ખવડાવવાથી મટે છે.

નાના બાળકને ભરાઈ જવાથી આંથકી(તાણ) આવતી કાંકચ શેકી, ભારીક વારીને માતા ધાવણમાં કે ગરમ પાણીમાં પિવડાવવાથી ફાયદો થાય છે.

શેકલી કાંકચનો એક માસો ગોળો અને બે રતી પિતપાપડો એકત્ર કરીને ગોળ સાથે ખાવાથી અથવા શેકેલી કાંકચના ગોળાનું ચૂર્ણ ધી માં ધાવાથી

કાંકચના પાનના રસમાં આંભા હળદર અને પિતપાપડો મેળવીને પીવાથી કૃમિ મટે છે.

વાઈ કે હિસ્ટીરિયામાં કાંકચનો ગોળો, એલથી અને જથી માંસીનું ચૂર્ણ મધ્યમાં મેળવીને અપાય છે કાંકચનો ગોળ ગોળ સાથે લેવાથી પણ હિસ્ટી રિયાનો હુમલો શાંત થાય છે.

કાંકચનાં પાન, વાંસના કુમળાં પાન, બકરીની લીંડીઓ એ ત્રણેને સાધારણ કુટી, ગોમૂહમાં બાફી, સહેવાય તેવું ગરમ નાના બાળકોના પેટ પર બાંધવાથી બાળકોનો ભાર(પેટ ભરાઈ આવવું) મટે છે.

કાંકચનાં પાનના રસમાં ધી મેળવીને પીવાથી અને સાથે ધી-ભાતનું પથા(પટેજુ) પાળવાથી ઉપદશમાં ફાયદો થાય છે.

કાંકચના ગોળાને તેલમાં કકડાવી, પીસીને ધા પર ચોપડવાથી ધા જલદી રૂઘાપ છે.

કાંકચ, આકડો અને એરંડો એ ત્રણેના પાન વાટી, ગરમ કરી, લેપ કરવાથી ત્રણા દિવસમાં સોજે ઉત્તરી જાય છે.

કાંકચના ગોળાને ધસીને સંધિવાના સોજ પર ચોપડાય છે. કાંકચના ગોળાને પીસીને કાટેલા તેલનું સંધિવા કે આમવાત પર મર્દન કરવાથી પણ ફાયદો થાય છે.

## ચંદનના વાધાની સેવાનો દિવ્ય લાભ

સંવત ૨૦૬૨ વૈશાખ સુદ-૩ તા. ૩૦-૪-૨૦૦૬ થી જેઠ સુદ-૧૫ તા. ૧૧-૬-૨૦૦૬ સુધી ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપશ્રી ગોપીનાથજી મહારાજ તથા શ્રીહરિનું કિશોર સ્વરૂપ એવા શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા દેવોને પાકી સુખદ તથા કેસર ના અતિ સુંદર અને કલાત્મક શાણગાર ધરાવવામાં આવે છે આ સેવાનો દિવ્ય લાભ લેવા વિનંતિ.

ચંદન આખા વાધાના - રૂ. ૩૫૦૦/-

ચંદન અડધા વાધાના - રૂ. ૨૧૦૦/-

તથા કુલન નહીં તો કુલની પાખડી રૂપે થથા શક્તિ સેવા કરી શકાય છે

નોંધ :- આ સેવા ચેક/ફ્રાન્સ/મનીઓર્ડર તથા રોકડ રમકથી આપી શ્રી ગોપીનાથજી દેવ મંદિરની પાકી પાવતી મેળવી લેવી.

## ● સંરથા સમાચાર ●

સંવત ૨૦૬૨ ફાગણ સુદ-પને તા. ૪-૩-૨૦૦૬ને શનિવાર ના રોજ ભગવાનશ્રી સ્વામિનારાયણ નું કિશોર સ્વરૂપ એવા શ્રી હરિકૃષ્ણમહારાજનો વાર્ષિક પાટોત્સવ ખુબજ ધામ ધુમથી ઉજવાયો હતો.

તા. ૩-૩-૨૦૦૬ ને શુક્રવારે સાંજે ૪-૦૦ કલાકે ધેલાનદીને કાંઠે યજમાન પરીવાર દ્વારા પૂજનનો કાર્યક્રમ થયો હતો ત્યાં થી બેન્ડપાર્ટી સાથે યજમાન પરિવાર ના બહેનો મસ્તક ઉપર કુંબ મુડી મંદિર માં પદ્ધરાયો હતો.

તા. ૪-૩-૨૦૦૬ના સવારે ૫-૧૫ કલાકે મંગળા આરતિ થઈ ત્યારબાદ ૬ થી ૭ અભિપેક ના સુંદર દર્શન થયા હતા. દુધ કેસર, મધ્ય, દહિ આદિ અનેક સામગ્રી થી અભિપેક ભ્ર. સ્વા. કપિલેશ્વરાનંદજી તથા ભ્ર. સ્વા. જ્ઞાનપ્રકાશાનંદજી આદિ બ્રહ્મચારીઓ એ કર્યો હતો. ૮ વાગે પૂ. સ્વા. ચંદ્રસ્વરૂપાનંદજી એ શાણગાર આરતિ ઉતારી હતી ત્યાર બાદ દાદાયારના દરબારગટમાં સુંદર સભાયોજાઈ હતી સભાનો પ્રારંભ ધૂન દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ. સ્વા. કૃષ્ણસેવાદાસજી તથા પૂ. સ્વા. ભક્તિવલ્લભદાસજી તથા શા. સ્વા. કૃષ્ણપ્રકાશદાસજી આદિ સંતો એ શ્રીહરિકૃષ્ણ મહારાજનો મહિમાં બતાવ્યો હતો. તથા ગટપુર મંદિરના કો. શા. સ્વા. ધનરથામવલ્લભદાસજી તથા શ્રી ઐસ. પી. સ્વામી એ યજમાન શ્રી ખોપણા નિવાસી શ્રી પરશોતમભાઈ કરશનભાઈ કુંગારાણી તથા સુપુત્રો શ્રી છગનભાઈ તથા ખોડાભાઈ તથા ધનજુભાઈ તથા ધરમશીભાઈ આદિ પરિવારને ખુબ ખુબ ધન્યવાદ આપ્યા હતા. અને ગટપુર મંદિર ના ચેરમેન પાર્ષદ શ્રી ભાણજી ભગત તથા ટ્રૂસ્ટીઓ અને સંતો દ્વારા શ્રી પરશોતમદાદા તથા તેમના ચારેય સુન્દરો ને પ્રાસાદિનો દાર, મૂર્તિ અને ખેસ અર્પણ કરી ભહુમાન કર્યું હતું આ પ્રસંગે ખોપણા તથા સરધાર થી સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર સભાનું સંચાલન સ્વા. છપૈયાપ્રકાશદાસજી એ કર્યું હતું. બપોરે ૧૧ કલાકે અશ્રકૃત આરતિ થઈ હતી. કો. સ્વા. વિશ્વવલ્લભદાસજી તથા કો. સ્વા. વિશ્વસ્વરૂપદાસજી એ સુંદર અશ્રકૃત તેયાર કર્યો હતો આ પાટોત્સવ પ્રસંગે તા. ૩-૩-૨૦૦૬ના રોજ રાત્રે પણ દરબારગટમાં સત્સંગ સભા થઈ હતી. જેમાં છપૈયાપ્રકાશદાસજી તથા કોઠારીશ્રી એ સત્સંગનો લાભ આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની જગભાથપુરી કે જ્યાં શ્રીહરિનો અભિન સંસ્કાર કરવામાં આવ્યો છે તથા આજે જ્યાંશ્રી હરિના અસ્થિનો કુંબ મિરાજુત છે તે લક્ષ્મીવાડીમાં તેજ જગ્યાએ મિરાજતા શ્રી સંહજાનંદ સ્વામી શ્રી ઈચ્છારામભાઈ તથા આદિ આચાર્યશ્રી રઘુવીરજુમહારાજ નો પાટોત્સવ ફાગણ વદ-૧ તા. ૧૫-૩-૨૦૦૬ના રોજ ભવ્યતાથી ઉજવાયો હતો. સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતિ થઈ પછી પાટોત્સવના યજમાન ઈંગોરાળા(ખાલસા) નિવાસી શ્રી કરશનભાઈ મેધજુભાઈ તથા પરિવાર દ્વારા પાટોત્સવ પૂર્વનું પૂજન શ્રી રૂપેશભાઈ તથા ચિરંજુતકુમારે કરાવ્યું હતું. ત્યાર બાદ અભિપેકમાં પ. પૂ. ૧૦૮ લાલજુશ્રી નૃગોદ્રમસાદજી મહારાજ પદાર્થ હતા અને દેવોનો અભિપેક કર્યો હતો. અને દરેક હરિભક્તો ને દર્શનનો લાભ આપી આનંદીત કર્યા હતા ૮ વાગે શાણગાર આરતિ પુજારી ભ્ર. સ્વા. કૃષ્ણપ્રકાશાનંદજી એ કરી હતી. ૧૧ વાગે અશ્રકૃત આરતિ થઈ હતી.

**ગટપુર માં શ્રી લાલજુમહારાજની ઉપસ્થિતીમાં ૬**

તા. ૧૫-૩-૨૦૦૬ના રોજ કુલદોલોત્સવ ગટપુર દરબારગટમાં અતિ ધામ ધુમથી ઉજવાયો હતો.

આ પ્રસંગે પ.પુ.૧૦૮ ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી નૃગોન્ડપ્રસાદજી મહારાજશ્રી પદ્ધાર્યા હતા. અને રંગે રમ્યા હતા. આ પ્રસંગે બોટાદ તેમજ આજુભાજુના વિસ્તારના હરિભક્તો એ અલભ્ય લાભ લિધો હતો દાદાખાચરના દરબારગટમાં પ.પુ.લાલજી મહારાજશ્રી પદ્ધાર્યા અને ભક્તોના હૈયા હર્થી ઘેલા થથા હતા. અને સૌ પ્રથમ ગટપુર મંદિરના કો.શા.સ્વા. શ્રી ધનશ્યામવલ્લભદાસજી તથા દ્વા.શા.સ્વા.જ્ઞાનપ્રકાશાનંદજી એ પ.પુ.લાલજીમહારાજને રંગ છાટયો હતો. પછી ગટપુર મંદિર ના ટ્રેસ્ટિ શ્રી ગોરધનભાઈ તથા હરજીભાઈ આદિઓ લાલજીમહારાજનું પૂજન કર્યું પછી લાલજીમહારાજે સંતો અને હરિભક્તો ને સૌપ્રથમ ગુલાલ પછી કેસુડાના રંગથી રંગી ભક્તોને ભાવવિભોર બનાવ્યા હતા.

લી. સ્વા. છપૈયાપ્રકાશદાસજી-ગટપુર

### પૂનમની સભા

ગટપુર અક્ષર ધામના મધ્યમાં પૂનમની સુંદર સત્સંગ સભાનું આયોજન દરપૂનમની જેમ થયું હતું. જેમાં ધૂનથી પ્રારંભ કરી શા.સ્વા. કૃષ્ણપ્રકાશદાસજી (કે.પી.સ્વામી) એ સત્સંગનો લાભ આપ્યો હતો. પછી ગટપુર મંદિરના કોઠારી શા.સ્વા. ધનશ્યામવલ્લભદાસજી એ પણ સુંદર સત્સંગનો લાભ આપ્યો હતો. સભાનું સંચાલન શા.સ્વા. છપૈયાપ્રકાશદાસજીએ કર્યું હતું.

અક્ષરધામનું મધ્ય એવા દાદાખાચરના દરબારગટમાં શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી તથા શા.શાંતિપ્રસાદદાસજીની શુભ પ્રેરણાથી વડોદરાના નરોતમભાઈ સેદાણી ના યજમાન પદે શ્રીમદ્ ભાગવત સખાઈ પારાયણ યોજાઈ હતી જેના વક્તા પદે ગટપુરના નવયુવાન શા.સ્વા. છપૈયાપ્રકાશદાસજી તથા શા.સ્વા. શાંતિપ્રિયદાસજી(દભાણ) ગુ.સ્વા. જગતપ્રકાશદાસજી એ સુંદર કથામૃત નું પાન કરાવી યજમા તથા હરિભક્તો સંતોનો રાજુપો મેળવ્યો હતો. કથા દરમ્યાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને શ્રીઝ્રમણણી વિવાહ અતિ ધામ દુધમથી ઉજવવામાં આવ્યો હતો સમાપ્તિમાં યજમાન પરિવારને શ્રી કોઠારી સ્વામી તથા શ્રી એસ.પી.સ્વામી એ આશિર્વાદ આપ્યા હતા. યેરેમેશ્રી પાર્ષ્વ ભાણજી ભગતે સુંદર ભગવાનની મૂર્તિ અને શ્રી શાંતિસ્વામી(ગટડા) એ શ્રી હરિની પ્રસારીની પેટી અર્પણ કરી હતી. આ પ્રસંગે સંહિતા પાઠનું વાંચન પુ.સ્વા. કૃષ્ણસેવાદાસજી એ કર્યું હતું. સભાનું સંચાલન શા.સ્વા. કૃષ્ણપ્રકાશદાસજી(કે.પી.સ્વામી) એ કર્યું હતું.

શ્રી સ્વામિનારાચણ સંપ્રદાયનું હૃદય અને સંપ્રદાયના ભાવિ આચાર્ય એવા પ.પુ.૧૦૮ લાલજી શ્રી નૃગોન્ડપ્રસાદજી મહારાજનો રંગ પંચમી એ રાજકોટ ના શારીરી મેદાન માં અતિ ભવ્યતાથી ૩૩ મો જનમિલિસ ઉજવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સૌ પ્રથમ ગટપુર મંદિરના કો.શા.સ્વા. ધનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી.સ્વામી તથા નિત્યસ્વરૂપસ્વામી સરધાર તથા શ્રી હરિદાસ્વામી તથા ભક્તિસંભવસ્વામી આદિસંતો એ સુંદર હારથી પૂજન કર્યું હતું ત્યાર બાદ લાલજી મહારાજે કેક કાપી શ્રી એસ.પી.સ્વામી તથા ગટપુર મંદિરના કોઠારી સ્વામીએ લાલજી મહારાજના ભજે હસ્ત પકડી સભામાં સૌને દર્શનનો લાભ આપાવ્યો હતો તેમજ લાલજી મહારાજને રંગે રોખાયા હતા. ત્યાર બાદ પદ્ધારેલા દરેક હરિભક્તો પરી શ્રી લાલજી મહારાજે રંગાની રેલમછેલ કરી હતી.

**શ્રી ગોપીનાથજી દેવ સહિતની ચૌદ મૂર્તિઓને થયેલ આખા થાળનું લીસ્ટ  
માહે ફેબ્રુઆરી - ૨૦૦૬**

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧	૧-૨-૦૬	વડોદરા	નિરજંનભાઈ	મેશુબ
૨	"	ખાલપર	ગોબરભાઈ રી.	અડટીયો
૩	"	ઠવી	કરશનભાઈ	મોતૈયા
૪	"	અમરેલી	શ્રી પી.પી.સોજીત્રા	અડટીયો
૫	"	વડોદરા	શ્રી સ્વામિનારાયણ	અડટીયો
૬	"	રાજકોટ	અ.નિ. લક્ષ્મીબેન	મોતૈયા
૭	"	માડલ	અ.નિ.નાથાલાલ	મગજ
૮	"	મુંબદી	પદમાબેન	દુધપુરી
૯	"	વંડા	લાલજીભાઈ બી.	કાજુમેશુબ
૧૦	"	વંડા	ભોળાભાઈ રી.	મોતૈયા
૧૧	"	ઘાર	ગોવિંદભાઈ કે.	મેશુબ
૧૨	"	વેળાવદર	કામજીભાઈ આંબાભાઈ	મેશુબ
૧૩	"	મલાડ	રાજુભાઈ અન.	મગજ
૧૪	"	વાળી	કોકીલાબેન	સુખરી
૧૫	"	મોટી વાવડી	પ્રવીણભાઈ જે.	મગજ
૧૬	૨-૨-૦૬	હરિપર	અ.નિ.શ્રીસ્વા. જગત પ્રકાશદાસજી	અડટીયો
૧૭	"	એકલાંડ	રાજન અમીત પાયલબેન	મગજપુરી
૧૮	"	શીકાંગો	કનુભાઈ રમણાલાલ	કાજુમેશુબ
૧૯	"	મુંબદી	નિતીનભાઈ	મગજ
૨૦	"	ઉત્તરસંડા	જશભાઈ ચતુરભાઈ	કાજુમેશુબ
૨૧	"	પદ્ધપાણા	વિરદીયા ગંગાબેન	મગજ
૨૨	૩-૨-૦૬	ટાટમ	શ્રી સ્વામિનારાયણ ગુરુકુણ	મગજપુરી
૨૩	"	ડભાડા	પુ.સ્વા.માધવપ્રસાદદાસજી	પૂરણ પુણી
૨૪	"	સુરત	લાલજીભાઈ મનજીભાઈ	મગજ
૨૫	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મગજ
૨૬	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મોહનથાળ
૨૭	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મોતૈયા લાડુ
૨૮	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મેશુબ
૨૯	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	અડટીયો
૩૦	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	અડટીયો
૩૧	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	બદામ મેશુબ
૩૨	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	કાજુ મેશુબ
૩૩	"	ડભાડા	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મગજ પુરી

\* શ્રી સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત \*

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૩૪	૩-૨-૦૬	ડભાણ	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	મેશુભ
૩૫	"	ડભાણ	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	અડદીયો
૩૬	"	ડભાણ	અ.નિ.પુ.સ્વા.જગતપ્રકાશદાસજી	કાજુ મેશુભ
૩૭	"	કાલાવડ	બાબુભાઈ માવદાનભાઈ ગઢવી	મગજ પુરી
૩૮	"	કાલાવડ	નરેશભાઈ બાબુભાઈ	મોહનથાળ
૩૯	"	હરિપ્ર	હરીભગત	મગજપુરી
૪૦	"	વડોદરા	ગીજુભાઈ ડી. પટેલ	અડદીયો
૪૧	"	રાણપુર	સોની બાબુભાઈ	મગજ પુરી
૪૨	૪-૨-૦૬	માંડવધાર	ટાકરશીભાઈ પરબતભાઈ	અડદીયો
૪૩	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જોખનપુત્રા	જાદીયુ
૪૪	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જોખનપુત્રા	ચુરમાના લાંડું
૪૫	૪-૨-૦૬	ગઢા	સ્વા.શ્રીહરીસેવા દાસજી ગઢા	ચુરમાના લાંડું
૪૬	"	સુરત	ગોરધનભાઈ ગોવિંદભાઈ	અડદીયો
૪૭	"	નવાગામ	જનકભાઈ નટુભાઈ ગઢીયા	કાજુમેશુભ
૪૮	"	ભીગરાડ	શેલૈશભાઈ બાલાભાઈ ગઢીયા	મગજ પુરી
૪૯	"	ગઢા	અ.નિ. ભં.સ્વા.મોહનપ્રસાદદાસજી	મગજપુરી
૫૦	"	નાશીક	ભગવાનભાઈ મોહનભાઈ	અડદીયો
૫૧	"	ધાટકપ્ર	મહેન્દ્રભાઈ એચ.	અડદીયો
૫૨	"	અમદાવાદ	જનકભાઈ વી.પટેલ	કાજુમેશુભ
૫૩	૬-૨-૦૬	રાજુલા	વિપુલભાઈ બી. પટેલ	કાજુમેશુભ
૫૪	"	આંબરડી	મહેશભાઈ એન તળાવીયા	મોતેયા
૫૫	"	તાવેડા	કુંભાણી અનસુયાબેન સંજ્યભાઈ	અડદીયો
૫૬	૭-૨-૦૬	વેળાવદર	મગનભાઈ પરશોત્તમભાઈ	મેશુભ
૫૭	"	ઉગામેડી	કરશનભાઈ પોપટભાઈ	મગજ
૫૮	"	ઠાસરા	અ.નિ. હોટાભાઈ બી.	મોહનથાળ
૫૯	"	અડતાળા	લુપતભાઈ રણધોડભાઈ	અડદીયો
૬૦	૮-૨-૦૬	ગઢા	હીતેશકુમાર અશોકભાઈ	અડદીયો
૬૧	"	મહેળાવ	અ.નિ. શારદાબેન	મગજ
૬૨	"	દામનગર	હિતેશભાઈ એન.	અડદીયો
૬૩	"	હરીપુર	પરેશભાઈ સવજીભાઈ	મગજ
૬૪	"	હરીપુર	પ્રપુલભાઈ જે.	મગજ
૬૫	"	અમદાવાદ	દ્યાળજીભાઈ (નીરમા વાળી)	મેશુભ
૬૬	૯-૨-૦૬	અમદાવાદ	અનંતરાયભાઈ માતંગી	અડદીયો
૬૭	"	અમરેલી	મનુભાઈ હરીદાસભાઈ	કાજુમેશુભ
૬૮	"	શેડુભાર	અરવિંદભાઈ વી.	મગજ
૬૯	"	સલદી	અ.નિ.ઠાકરશીભાઈ ડી.	અડદીયો

\* શ્રી સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત \*

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૭૦	૮-૨-૦૬	સોગઠ	હરિભક્ત	હુધપુરી
૭૧	"	બુવા	અ.નિ.સોમાભાઈ	ચુરમાના લાડું
૭૨	"	ડલ્લાણ	અ.નિ. જગતપ્રકશદાસજી	મગજપુરી
૭૩	"	ગુંદાળા	કાળુભાઈ વશરામભાઈ	મોતેયા
૭૪	"	અમદાવાદ	શ્રી સ્વામિનારાયણ ફાર્મસી	કાજુમેશુબ
૭૫	૧૦-૨-૦૬	ચમારડી	સમીર બી. જેબનપુરા	હુધપાક
૭૬	"	મુંબઈ	અલ્યાબેન ગોકળભાઈ	અડદીયો
૭૭	૧૧-૨-૦૬	સાકરપરા	કંચનબેન ગોકળભાઈ	મગજ
૭૮	"	વેળાવદર	કાળુભાઈ વાધજીભાઈ	મગજ
૭૯	"	કંકય	ગોરધનભાઈ	મગજ
૮૦	"	વાપી	યમુના મીશન	અડદીયો
૮૧	"	શાંતીનગર	કાંતીભાઈ છગનભાઈ	અડદીયો
૮૨	"	પરવાળા	ત્રીકમભાઈ પી.	અડદીયો
૮૩	"	મુંબઈ	છગનભાઈ હુદાભાઈ	અડદીયો
૮૪	"	પલાણા	ભુપેન્દ્રકુમાર ચંદુભાઈ	મગજ
૮૫	૧૨-૨-૦૬	ઉમરેઠ	શારદાબેન	અડદીયો
૮૬	"	છાપરી	કાનજીભાઈ એન.	હુધપુરી
૮૭	"	સુરત	ગોરધનભાઈ એન.	મગજ
૮૮	"	બોટાદ	સ્વા. ગુરુકુળ હ. બ્ન. ધર્મજીવનદાસજી	અડદીયો
૮૯	"	અમદાવાદ	જીજેશકુમાર	મોહનથાળ
૯૦	"	શેડુભાર	ભીખાભાઈ જી.	મોહનથાળ
૯૧	"	અમદાવાદ	ઉધાબેન	મોહનથાળ
૯૨	"	નાયાડ	સુરેશભાઈ	મગજ
૯૩	૧૩-૨-૦૬	વેળાવદર	રામભાઈ રણથોડભાઈ	મોહનથાળ
૯૪	"	વડોદરા	ચોકસી પ્રવીણભાઈ	મેશુબ
૯૫	"	અમરેલી	સોની બળવંતરાય	મગજ પુરી
૯૬	"	નવાગામ	હરિભક્ત	અડદીયો
૯૭	"	ગોડલ	શ્રી સ્વામિ ગુરુકુળ	મગજ
૯૮	"	અમરેલી	શ્રી કાર્તીકભાઈ	બદામ મેશુબ
૯૯	"	મુંબઈ	શ્રી ૨જનીકાંતભાઈ ગોપાળભાઈ	હુધપાક
૧૦૦	"	ભાવનગર	રમાબેન	મોહનથાળ
૧૦૧	૧૨-૧-૦૬	ઠાગલા	અલ્યેશભાઈ ઓધવજીભાઈ	મેશુબ
૧૦૨	"	અકણા	રમેશભાઈ પ્રેમજીભાઈ	મગજ
૧૦૩	"	ગઢા	કિઝા અર્થ મુવર્સ	મગજ
૧૦૪	"	ઉગામડી	ભગવાનભાઈ મેધાભાઈ	મેશુબ
૧૦૫	૧૩-૨-૦૬	ભાવનગર	અનિતાબેન ધીરુભાઈ	જાદરીયુ

\* શ્રી સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત \*

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧૦૬	૧૩-૨-૦૬	ખસ	હસમુખભાઈ ખોડાભાઈ	મોતૈયા
૧૦૭	"	જરખીયા	ઉકાભાઈ નાનજીભાઈ	મગજ
૧૦૮	"	અકળા	અગવાનભાઈ રામજીભાઈ	અડટીયો
૧૦૯	"	તલગાજરડા	બીજલભાઈ ડાયાભાઈ	અડટીયો
૧૧૦	"	લાઠી	ગીરીશભાઈ રતીલાલ	મોતૈયા
૧૧૧	"	રાજકોટ	ગૌરીબેન વાલજીભાઈ	મેશુબ
૧૧૨	"	કરમડા	ભુદ્રભાઈ કાનજીભાઈ	મગજ
૧૧૩	"	પીઠવડી	લાલજીભાઈ વલ્લભભાઈ	મગજ
૧૧૪	"	બોટાદ	ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ	મગજ
૧૧૫	"	ચાંદખેડા	કુમળાબેન જશુભાઈ	મગજ
૧૧૬	૧૪-૨-૦૬	મુંબદી	કિરીટભાઈ જીવણભાઈ બાખડા	દુધપુરી
૧૧૭	"	પીપરલા	થીથરભાઈ જયશંકર	મોતૈયા
૧૧૮	"	દેવમજુયા	જેરામભાઈ શામજીભાઈ	મેશુબ
૧૧૯	"	મુંબદી	ચેતનભાઈ નિરંજનભાઈ	મગજ
૧૨૦	"	પીપરડી	પ્રાગજીભાઈ નરશીભાઈ	દુધપુરી
૧૨૧	"	ભાવનગર	કનુભાઈ ત્રયલંકભાઈ	અડટીયો
૧૨૨	"	ભાવનગર	નવીનચંદ શાંતીલાલ	મગજ
૧૨૩	"	ખીજડીયા	અરજણભાઈ ધુંસાભાઈ	કાજુમેશુબ
૧૨૪	"	ખીજડીયા	ચેતનકુમાર અરડણભાઈ	અડટીયો
૧૨૫	૧૫-૨-૦૬	અમદાવાદ	શ્રી નારાયણભાઈ ગીગાભાઈ	મગજ
૧૨૬	૧૬-૨-૦૬	ગઢા	શા.સ્વા.ઇપૈયાપ્રકાશદાસજી	બદામ મેશુબ
૧૨૭	"	ખોપાળા	અ.નિ.કાળુભાઈ કુંગરાણી	મગજ
૧૨૮	"	જીંજુડા	સંગીતાબેન	મગજ
૧૨૯	"	સુખપર(કચ્છ)	ઘનજીભાઈ વિરજીભાઈ	મગજ
૧૩૦	"	પીઠવડી	ધર્મન્દ્રકુમાર બી.	મેશુબ
૧૩૧	"	સલદી	વિનુભાઈ આર.	અડટીયો
૧૩૨	"	યુ.એસ.એ.	રજનીભાઈ પટેલ	દુધ પુરી
૧૩૩	"	સુરત	વસંતભાઈ પી.	મોહનથાળ
૧૩૪	"	પીપરલા	સભીરભાઈ એમ.	અડટીયો
૧૩૫	૧૮-૨-૦૬	મુંબદી	દીપકુમાર ભગવાનદાસ	મગજ
૧૩૬	"	મુંબદી	ચુનીલાલ મગનલાલ	અડટીયો
૧૩૭	"	વડોદરા	અ.નિ. દલસુખભાઈ	અડટીયો
૧૩૮	"	ઉત્તરસંડા	કુસુમબેન પ્રવીણચંદ	અડટીયો
૧૩૯	"	અમદાવાદ	મધુબેન દીપકભાઈ	મગજ
૧૪૦	"	અમદાવાદ	તૃષાબેન કૃષાલભાઈ	મગજ
૧૪૧	"	યુ.એસ.એ.	નિમેશકુમાર	મગજ

\* શ્રી સ્વામિનારાયણ ધર્મસિદ્ધાંત \*

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧૪૨	૧૮-૨-૦૬	અમદાવાદ	જગરભાઈ દીપકભાઈ	મગજ
૧૪૩	"	અમદાવાદ	લલીતાબેન	સુખડી
૧૪૪	"	મુંબઈ	મારૂતી કલોથીંગ	મોતૈયા
૧૪૫	૧૮-૨-૦૬	વસો	આર્યન ધનશયામભાઈ	મોતૈયા
૧૪૬	"	અમદાવાદ	સાંતીલાલ નાથાલાલ	મગજપુરી
૧૪૭	"	રાજકોટ	રીનાબેન ધીરુભાઈ	સાટા
૧૪૮	"	ગઢા	અંજુબેન નરેન્દ્રભાઈ	મેશુબ
૧૪૯	"	વડોદરા	ગાંધી નંદકિશોર	મેશુબ
૧૫૦	"	વડોદરા	સુરેશભાઈ એમ. ટક્કર	મોતૈયા
૧૫૧	૨૦-૨-૦૬	અમદાવાદ	કુમલેશભાઈ શાહ	ધારીપુરી
૧૫૨	૨૧-૨-૦૬	ભાવનગર	મંગળાબેન શરદ્ધકુમાર	મેશુબ
૧૫૩	૨૨-૨-૦૬	ઠાસા	હરીભગત	મગજ
૧૫૪	૨૩-૨-૦૬	વડોદરા	જયકુવરબેન	મગજ
૧૫૫	૨૪-૨-૦૬	ઉમરેઠ	નવિનચંદ્રભાઈ	કાજુમેસુબ
૧૫૬	૨૫-૨-૦૬	વડોદરા	દિપાબેન	અડટીયો
૧૫૭	૨૬-૨-૦૬	ભેરાઈ	અ.નિ. સોનાય આઈ	મોતૈયા
૧૫૮	"	ભેરાઈ	અ.નિ. સોનાય આઈ	મોતૈયા
૧૫૯	"	ગઢા	પા. ભાણજીભગત	કાજુ મેસુબ
૧૬૦	"	મુંબઈ	રાજુકુમાર મુંકંદભાઈ કાઢીયા	મેશુબ
૧૬૧	"	અમદાવાદ	અ.નિ. ડાયાભાઈ	મેશુબ
૧૬૨	૨૭-૨-૦૬	કાચરડી	હસમુખભાઈ	મગજ
૧૬૩	"	નાગાવ	ચન્દ્રકાન્તભાઈ ભાઈશંકર	દુખપાક
૧૬૪	"	અંબરડી	ધોળીબેન	મગજ
૧૬૫	"	ગઢા	શા. સ્વા. છપૈયાપ્રકાશદાસજી	બદામમેસુબ
૧૬૬	"	મુંબઈ	અ.નિ. મનસુખભાઈ ગોકુળદાસ	અડટીયો
૧૬૭	૧૮-૨-૦૬	હાલોલ	બાબુભાઈ આર	મગજ
૧૬૮	"	સુરત	રસીલાબેન	મગજ
૧૬૯	"	સુરત	સોમલબેન	મગજ
૧૭૦	"	સુરત	સોનલબેન	મેશુબ
૧૭૧	"	ગઢા	પ્રવીણભાઈ	મગજ
૧૭૨	"	ઉમરાળા	પોપટભાઈ	મગજ
૧૭૩	"	પીઠવડી	અરજણભાઈ પી.	મેશુબ
૧૭૪	"	સધાણા	રસીકભાઈ એન	અડટીયો

**માહે ફેબ્રુઆરી-૨૦૦૬ માં શ્રી ગોપીનાથજી મહારાજનો થાળ તથા  
ત્યાગી-સંતો બ્રહ્મચારી અને પાર્ષ્ડોને આપવામાં આવેલ રસોઈના દાતાઓની યાદી**

અ. નં	તારીખ	મહિનાના અને તીથી	ગામ	નામ	રસોઈની વિગત
૧	૨-૨-૦૬	મહા સુદ - ૫	ખોપાટા	જેરામભાઈ ડોસાભાઈ પટેલ	દુધપાર, ભજુયા
૨	૩-૨-૦૬	" ૬	ડલભાણ	અ. નિ. પુ. સ્વા. જગતપ્રકાશદાસજી	રસોઈ સીધા નિભિતે
૩	૪-૨-૦૬	" ૭	રાજકોટ	મનીષકુમાર જેલનપુરા	રસોઈ સીધા નિભિતે
૪	૪-૨-૦૬	" ૭	આંબરકડી	લક્ષ્મણભાઈ લુરાભાઈ	મોતેયાલાંડું, ભજુયા
૫	૮-૨-૦૬	" ૧૧	અમદાવાદ	રમેશચંદ્ર ભોગીલાલ પટેલ	રસોઈ સીધા નિભિતે
૬	૯-૨-૦૬	" ૧૨	ગઠડા	સ્વ. સ. ગુ. સ્વા. મોરલીમનોહરદાસજીની તીથી ચુરમા લાંડું, ભજુયા નિભિતે હસ્તે સ્વા. ભક્તિપ્રકાશદાસજી તથા સ્વા. બાલકૃષ્ણદાસજી	ચુરમા લાંડું, ભજુયા
૭	૯-૨-૦૬	" ૧૨	પાલીતાણા	મણાબેન માધવજીભાઈ ઘેલાણી	રસોઈ સીધા નિભિતે
૮	૯-૨-૦૬	" ૧૨	છાપરી	અ. નિ. શામજીભાઈ હરજીભાઈ	રસોઈ સીધા નિભિતે
૯	૧૦-૨-૦૬	" ૧૩	ધર્મજ	ગંગાલા મોતીભાઈ પટેલ	રસોઈ સીધા નિભિતે
૧૦	૧૦-૨-૦૬	" ૧૩	નાર	રસીકભાઈ દી પટેલ	રસોઈ સીધા નિભિતે
૧૧	૧૧-૨-૦૬	" ૧૪	ભાડા	અ. નિ. ભવાનભાઈ મામભાઈ માંગુકીયા	મોતેયાલાંડું, મોહનથાળ સાટા, અડદીયો, ભજુયા
૧૨	૧૩-૨-૦૬	" ૧૫	પુના	રવિભાઈ જવાહરભાઈ ચોહાણ	અડદીયો, ગાંઢીયા.
૧૩	૧૫-૨-૦૬	મહા વદ - ૨	મુંબઈ/રાજકોટ	પાનાયંદભાઈ માધવજીભાઈ તથા ગોરધનભાઈ મોહનથાળ, ભજુયા મોહનભાઈ કોરાડ	
૧૪	૧૬-૨-૦૬	" ૩	ગઠડા	સ. ગુ. કો. પુ. સ્વા. નરનારાયદાસજી સ્વ. બં. સ્વા. પુરણપોળી, નારાણપ્રીયદાસજીની તીથી નિભિતે હસ્તે મરચાનાભજુયા ધનશ્યામવલ્લદાસજી તથા સ્વા.	મરચાનાભજુયા
૧૫	૧૭-૨-૦૬	" ૪	રંગપર	નરેન્દ્રભાઈ સી. મહેતા સહ પરિવાર	ચુરમાલાંડું મરચાનાભજુયા
૧૬	૧૮-૨-૦૬	" ૫	પાળીયાદ	વડોદરીયા પ્રવિષ્ટચંદ્ર રતીલાલ શ્રી ધનશ્યામ કાજુમેસુલ, મેથીના	
૧૭	૧૮-૨-૦૬	" ૫	કાંકચ	મહારાજના પાટોત્સવ નીભિતે	ગોટા
૧૮	૧૮-૨-૦૬	" ૬	ભાવનગર	અ. નિ. ગંગાલેન પુનાભાઈ	રસોઈ સીધા નિભિતે
૧૯	૧૮-૨-૦૬	" ૬	ગઠડા	ધનશ્યામભાઈ મનજીભાઈ વેલડીયા	રસોઈ સીધા નિભિતે
				અ. નિ. સ. ગુ. કો. સ્વા. ધર્મકિશોરદાસજી હસ્તે મોતેયા લાંડું, ગાંઢીયા	
				કો. પુ. સ્વા. શાંતીસ્વરૂપદાસજી તથા પા. સુરેશ ભગત	

**માહે ફેબ્રુઆરી-૨૦૦૬ માં શ્રી ગોપીનાથજી મહારાજનો થાળ તથા  
ત્યાગી-સંતો બ્રહ્મચારી અને પાર્ષ્ડોને આપવામાં આવેલ રસોઈના દાતાઓની યાદી**

અ. નં	તારીખ	મહિના અને તીથી	ગામ	નામ	રસોઈની વિગત
૨૦	૨૦-૨-૦૬	મહા ૧૮- ૭	ગાડા	સાં. યો. સવિતાબા ગુરુ સાં. યો. દિવાળીબા હસ્તફાડાલાપસી, મેશુબ, સાં. યો. ભાવનાલેન પારાયણ નિભિતે	ભજુયા
૨૧	૨૧-૨-૦૬	" ૮	ગાડા	સાં. યો. સવિતાબા ગુરુ સાં. યો. દિવાળીબા હસ્તરસોઈ સીધા નિભિતે	
૨૨	૨૧-૨-૦૬	" ૯	લંડન	વિલ્સડન સંતસંગ સમાજ હસ્તે સ્વા. દુધપાક, ભજુયા	
૨૩	૨૨-૨-૦૬	" ૧૦	ગાંધીનગર	શા. સ્વા. હરિપ્રકાશદાસજી તથા સ્વામી ગુરુકુળ અડદીયો, સાટા, જલેઝી, ગાંધીનગર અ. નિ. સ્વા. હરિચરણદાસજુની સેવમમરી, સાટા	
૨૪	૨૨-૨-૦૬	" ૧૧	ચાણપુર	સુમનભાઈ જીવાભાઈ ચોહાણ	રસોઈ સીધા નિભિતે
૨૫	૨૨-૨-૦૬	" ૧૨	ગાડા	સા. યો. સવિતાબા ગુ. સાં. યો. દિવાળીબા પારાયણ રસોઈ સીધા નિભિતે	
૨૬	૨૩-૨-૦૬	" ૧૩	ગાડા	નિભિતે હસ્ત સાં. યો. ભાવનાલેન	
૨૭	૨૪-૨-૦૬	" ૧૪	ગાડા	સા. યો. સવિતાબા ગુ. સાં. યો. દિવાળીબા પારાયણ શીરો, મોરેયાની ખીચડી	
૨૮	૨૪-૨-૦૬	" ૧૫	ગાડા	નિભિતે હસ્ત સાં. યો. ભાવનાલેન	ફરાણી રસોઈ
૨૯	૨૫-૨-૦૬	" ૧૬	ગાડા	સા. યો. સવિતાબા ગુ. સાં. યો. દિવાળીબા પારાયણ અડદીયો, મોહનયાણ,	
૩૦	૨૫-૨-૦૬	" ૧૭	મીરજાપુર	નિભિતે હસ્ત સાં. યો. ભાવનાલેન	ભજુયા, ગાંઠીયા
૩૧	૨૬-૨-૦૬	" ૧૮/૩૦	મુંબઈ	સોની હાર્દિકકુમાર દિલીપભાઈ ધાનક	રસોઈ સીધા નિભિતે
૩૨	૨૬-૨-૦૬	" ૧૯/૩૦	ગુંડાળા	લાલજીભાઈ લવાનભાઈ પટેલ હસ્તે મોતેયા લાંડ, ગાંઠીયા	
૩૩	૨૮-૨-૦૬	કંગણ સું-૧	વડદલા	સ્વા. ઈશ્વરજીવનદાસજી પ્રવિષણભાઈ વાધજીભાઈ પટેલ તથા અ. નિ. શીખંડ, રોટલી, ભટેટા	
				વાધજીભાઈ એમ. પટેલ પારાયણ નિભિતે	વડા

## પૈશાખ મહિનામાં થનાર અનામત તીથીની રસોઈની ચાદી

અ. નં	તારીખ	મહિનાને તીથી	ગામ	અનામત રકમ રૂ.માં	નામ	વિગત
૧	૨૬-૪-૦૬	પૈશાખ ચુદ-૨	મોટા આંગુડા	૩૫૦૦૦/-	ભગવાનદાસ હરીલાલ મહેતા	ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૨	૧-૫-૦૬	" " ૪	ગાઠડા	૩૦૦૦૦/-	સ.ગૃ.પુ.સ્વા.હરીપ્રીયદાસજી તથા બં.સ્વા.મોહનપ્રસાદદાસજી	સ.ગૃ.કો.સ્વા.લક્ષ્મીપ્રસાદદાસજીની તીથી નિમિતે સંતોને રસોઈ કરી જમાડવા
૩	૨-૫-૦૬	" " ૫	ગાઠડા	૨૫૦૦૧/-	બ્ર.સ્વા. સુર્યપ્રકાશાનંદજી તથા સત્સંગ સમાજ ધંધુકા, તળાજા તથા ગાંડલ	ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૪	૪-૫-૦૬	" " ૭	ગુંડાળા/કમળાપુર	૩૫૦૦૦/-	શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ	સ્વા.રામસ્વરૂપદાસજીની અ.વા. તીથી નિમિતે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૫	૧૦-૫-૦૬	" " ૧૨	બળદીયા (કરણ)	૨૫૦૦૧/-	કાનજુભાઈ રામજુભાઈ સવાણી તથા ધર્મપણી ધનબાઈ	રામજુભાઈ તથા અમરબાઈના મોકાર્યે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૬	૧૭-૫-૦૬	પૈશાખ વદ-૬	ગાઠડા	૪૦૦૦૦/-	પા.ભીમજી ભગત ગૃ.પા.હિરજી ભગત	ગૃ.પા.હિરજુભગતની અ.વા. તીથી નિમિતે સંતોને રસોઈ કરી જમાડવા
૭	૨૨-૫-૦૬	" " ૧૦	સુખપુર (કરણ)	૫૦૦૦૦/-	વિહુલભાઈ વાલજુભાઈ કેરાઈ	ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૮	૨૬-૫-૦૬	" " ૧૪	ગાઠડા	૫૦૦૦૦/-	સ.ગૃ.સ્વા.નારાણવલ્લભદાસજી	અ.નિ.લં.સ.સ્વા. મોરલીધરદાસજીની તીથી નિમિતે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
	૨૭-૫-૦૬	" અમાસ	ગાઠડા	૩૫૦૦૦/-	સ.ગૃ.સ્વા.શામળીયાચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય પરવાળા	સ.ગૃ.સ્વા.શામળીયા ચૈતન્યાનંદ સ્વામીના તીથી નિમિતે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા

-: નોંધ :-

ઉપરોક્ત થનાર રસોઈમાં અનામતની રકમના વ્યાજમાં ઘટતી રકમ ભરવાની રહેશે જેની નોંધ લેવા વિનંતિ